

Published on 10th of every month

ગ્રામસ્વરાજ

અંક : ૩ • વર્ષ : ૭૮ • ૧૦ જૂન, ૨૦૨૪

કિંમત : ₹ ૭ • વાર્ષિક લવાજમ : ₹ ૮૦

GRAMSWARAJ GUJ. MONTHLY
RNI No. 1799/57 Permitted to
post at Ahmedabad P.S.O. on
tenth of every month under postal
Regd. No. GAMC 3E, 2024-2026
issued by S.S.P. Ahmedabad
valid upto 31-12-2026, Licence
to Post without prepayment
No. PMG/ING/049/2024-2026
valid upto 31-12-2026

૨૧ જૂન, વિશ્વ યોગ દિવસ



માનવતાની મહેક પ્રસરાવવા યોગમય બનીએ

અંક-૩ • પદ્ધતિ: ૭૮

૧૦, જૂન ૨૦૨૪

તંત્રી: ડૉ. રાહેન સી. વિષેટી

સંપાદક મંડળ

- ઘનશ્યામભાઈ બેચ, અમીન
- ભીખાભાઈ જ. પટેલ
- વાર્ષિક લવાજમ : રૂ.૮૦
- છૂટક નકલ : રૂ.૫

ઘનશ્યામભાઈનું અને લવાજમ
મોકલવાનું સરનામું :

ગુજરાત રાજ્ય સહકારી સંય

સહયોગ, જ્ઞાનોનિ સંયની પાઠ્ય, રિલીફ રોડ,
અમદાવાદ-૩૮૦ ૦૦૧,

ફોન: ૨૪૩૪૨૨૨૦ (૧૮૩) ફેક્સ: સહયોગ
ફેક્સ નં.: (૦૭૯) ૨૪૩૪૦૩૦

Website : www.gujaratscu.com
E-mail : sahakarguj1850@gmail.com

અનુક્રમણિકા

જી એ જ જવન	૩
જીવનદાયી જીણ ભયાવહા માટે	૪
સૌ કોઈ પોતાની જવાબદારી નિયમો	૫
વિશેકપૂર્ણ ઉપયોગ કરા વિશાળ જીણ	૬
અંડારનું નિયમાંથી - શ્રી હિન્દુ ખુરાના	૭
પર્યાવરણ ભયાવહા ના જરિયોમાં સર્વસંમતિ	
જી માટે જરૂરી ?	૧૦
જી છું તો જવન છું...	
- ડૉ. ઉશોર સાહુ	૧૮
ગીતાસાલી : જીણમંચયમાં આત્મનિર્ભર બનેશું જામ	૨૦
ઓઝિટલ યુગમાં બધા સાઈટ્સ ગુનાથી	
સાચ્યાન રહો - શ્રી કાનકભાઈ ભાલાણ	૨૮
ધોગમય બનીએ માનવતાની મહેક પ્રસરાવીએ	
- ધોગમાયક ડિરણ ચાંપાનેરી	૩૨

ગ્રામ સ્વરાજ

- દર મહિનાની દસ્તી તારીખે પ્રગત થાય છે.
- નાનું વર્ષ એપ્રિલથી શરૂ થાય છે. વાર્ષિક લવાજમ રૂ.૮૦ છે.
- છૂટક નકલ રૂ.૫-૦૦ જમે તે અંકથી આદક બઠી શકે છે. લેખમાં પ્રગત બતાવિયારે લેખકના છે.
પ્રકાશિત બતાવે લેખો જાણે તત્ત્વી કે સંપાદક મંડળ સંમત છે, તેવું માનવું નહીં.
- ગુજરાત રાજ્યની સહકારી મંડળીઓના કાયદા કષમ-હણ અનુસાર ગુજરાત રાજ્ય સહકારી સંયના
શિક્ષણ કાળામાં નિયમિત કાળો ભરનાર સહકારી સંસ્થાને વિના લવાજમે 'આમસ્વરાજ' મોકલવામાં આવે છે.
- 'આમસ્વરાજ' માસિક તથા 'સહકાર' પાશ્ચિકનું સંયુક્ત લવાજમ રૂ.૧૫૦.૦૦ છે.
- રાજ્ય સહકારી સંયના સભાસદોને "આમસ્વરાજ" તથા "સહકાર" વિના લવાજમે મોકલવામાં આવે છે.

જળ અને જળવન

પ્રાચીન ભારતીયો પૃથ્વી પર જળનું મહત્વ સારી રીતે જાણતાં-સમજતાં હતાં, પ્રાચીન માન્યતાઓ મુજબ, બ્રહ્માંડ પાંચ મૂળભૂત તત્ત્વો કે પંચમહાભૂતનું બનેલું છે: પૃથ્વી, જળ, અઞ્ચિ, વાયુ અને આકાશ, અને મુજબ, તમામ જીવન જળ સાથે સંકળાયેલા છે. શુદ્ધ પાણી તેની શીતળતા, સ્વચ્છતા, પારદર્શકતા, તટસ્થતા અને ઉપયોગી તત્ત્વોને કારણે દિવ્યજળ કહેવાતું હતું. આ ઉપરાંત જળના તબીબી ગુણધર્મોના પુષ્ટ સંદર્ભો પણ મળે છે.

પૃથ્વીના બે તૃત્યાંશ ભાગમાં પાણી છે અને માનવીય શરીરનો ઉપ ટકા હિસ્સો પાણીનો છે. એટલે સ્પષ્ટ છે કે પૃથ્વી પર જીવન માટે પાણી સૌથી મુખ્ય તત્ત્વ છે. આદિકાળથી દુનિયાની મોટાભાગની સંસ્કૃતિઓ નદીકિનારે જ પાંગરી છે. આપણા પૂર્વજીએ બેતીવાડી કરવા જળની ઉપલબ્ધતા વિસ્તારોની આસપાસ નાન શહેરોની રચના કરી હતી, કારણ કે મનુષ્ય જીવનનો આધાર પાણી છે.

અત્યારે આ કિમતી સંસાધન આપણા અર્થતંત્ર માટે અતિ મહત્વપૂર્ણ પરિબળ બની ગયું છે. તે ફક્ત બેતીવાડી, ઉદ્યોગ, પરિવહન માટે જ આવશ્યક ઘટક નથી, પણ વન્યજીવન, મનોરંજન અને પર્યાવરણ માટે પણ આધારભૂત પરિબળ છે. જોકે અગાઉથી વિપરીત આધુનિક સમાજ જીવનના આ ચમત્કારિક ઘટક પ્રત્યે

ઉદાસ્કિનતા સેવે છે. નદીઓ, સમુદ્રો અને મહાસાગરોનો અયોગ્ય રીતે ઉપયોગ થઈ રહ્યો છે અને તેને મોટા પાયે પ્રદૂષિત કરવામાં આવે છે, જેના પગલે દુનિયાના લગભગ મોટાભાગના વિસ્તારોમાં પાણી દુર્લભ ચીજવસ્તુ બની ગઈ છે. ગામડાઓમાં ઘરગથ્યું ઉપયોગ માટે પાણીની શોધમાં કિમતી માનવીય દિવસોનું નુકસાન થઈ રહ્યું છે. શહેરી વિસ્તારોમાં પણ પાણીને લઈને અવારનવાર લડાઈ થાય છે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પાણીની તીવ્ર બેંચ જોવા મળે છે, જેના પગલે કૃષિને મોટા પાયે નુકસાન થાય છે અને કૃષિના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. પાક નિષ્ઠળ જવાથી નિરાશ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. બીજી તરફ, દર વર્ષે કોઈને કોઈ ભાગમાં પૂર આવવાથી જીનમાલની મોટા પાયે હાનિ થઈ રહી છે.

આ સ્થિતિની ગંભીરતા સમજને દુનિયાભરના નિષ્ણાતો જળનું સંરક્ષણ કરવા નવા માર્ગો શોધી રહ્યા છે. સરકારો પાણી સંબંધિત સમસ્યાઓનું સમાધાન કરવા માટે નીતિનિર્દેશો ઘડવામાં વ્યસ્ત છે. ભારત સરકારે ખેડૂતો અને સામાન્ય નાગરિક એમ બંને માટે પૂર અને દુષ્કાળગ્રસ્ત લોકોની સમસ્યા હળવી કરવા વિવિધ પગલાં લીધાં છે.

સિંચાઈની આધુનિક પદ્ધતિઓ વિશે ખેડૂતોને
(અનુ. પાના નં. ૧૫ પર)

જીવનદાયી જળ બચાવવા માટે સૌ કોઈ પોતાની જવાબદારી નિભાવે

જળ સંચયની જરૂર ખૂબ જરૂરી છે. જળ એજ માનવ બળ એમ કહેવું અતિશયોક્તિ ભર્યું નથી. શહેરી વિસ્તારો જળ સંકટ કરે તેવી અપેક્ષા રાખવી વધારે પડતી નથી. ઘરના લોકો વધારાનું પાણી ગટરમાં વહાવી દે છે, જ્યાં એક ડેલનો વપરાશનો હોય ત્યાં બજ્બે ડેલ પાણી ફોગટનું વપરાય છે એટલે આવા વેડફાટથી બચવું ખૂબ જ જરૂરી છે. કેટલાક ઘરોમાં જ્યારે પાણી આપવાનું શરૂ થાય ત્યારે જરૂર પૂરતું પીવાનું પાણી એકત્ર કરી લે છે. તો મોટરથી પાણી બેંચીને સિન્ટેક્ષની ટાંકી

ચિક્કાર કરીને પાણીનો સંગ્રહ કરી લે છે. કેટલાક લોકો સ્કૂટર, બાઈક અને કાર ધોવામાં અનેક ગણું પાણી વેડફી નાખે છે. રસ્તા પર ધૂળ ન ઉતે તેટલા માટે બે ત્રાણ બાલટી પાણી વેડફી નાખે છે. કેટલાક લોકો બગીચામાં પાણી વેડફે છે. કેટલાક હવાડામાં પાણી ભરે છે. ઢોરઢાંખર માટે હવાડા જરૂરી છે. બગીચાના છોડને પણ પાણી સિંચવું આવશ્યક છે. પરંતુ તે માફક્સરનું હોવું જોઈએ. બીનજરૂરી પાણીનો

વેડફાટ કરવો યોગ્ય નથી. પીવા લાયક પાણી ભરી લીધા પછી નળ નીચે બાલ્ટી મૂકી દઈ, નળ ચાલુ રાખીને ગૃહિણી ઘરના કામમાં ગોઠવાઈ જાય છે. તે વખતે તેને ઘ્યાલ નથી રહેતો કે નળનો નોબ ખુલ્લો રહી ગયો છે. અને પાણી ખોટું ખોટું ઓવર ફ્લો થઈને ગટરમાં વહી રહ્યું છે. આપણે વરસાદી પાણીનો સંચય નથી કરી શકતા. કેટલાક સમજુ લોકો ભૂગર્ભ ટાંકામાં વરસાદી પાણીનો સંધરો કરી લે છે. ટાંકામાં સંધરાયેલું આ પાણી ગમે ત્યારે કામમાં આવી શકતું હોય છે.

ખેતરમાં અને વાડીમાં ફૂવા-વાવ હોય છે. આ ફૂવા-વાવના તળ ભર ઉનાળે ખાલી હોવાની સ્થિતિ સર્જાતી હોય છે. તેવા સમયે ભૂગર્ભ ટાંકામાં પાણી સંગ્રહેલું હશે તો તમે કટોકટી વખતે કામમાં આવી શકે છે. એટલે નાગરિકોએ પોતાની જવાબદારી ચિંતા સાથે નિભાવવી જોઈએ. જળ સંચય દ્વારા જળના બચાવ માટે દરેકે ગંભીર બનવું જોઈએ. જળ જીવનદાયી છે. તેનો અવશ્ય બચાવ થવો

❖ ❖ ❖ ❖ ❖ ❖ ❖ • ગ્રામસ્વરાજ • ❖ ❖ ❖ ❖ ❖ ❖ ❖

જોઈએ.

આ વખતે ભારતીય માહોલ સારા વરસાદ સાથે ખીલી ઉઠ્શે એમ મોસમનો વર્તારો કહે છે. મોસમ વિભાગે સારા વરસાદ થવાની આગાહી રજૂ કરી છે. મોસમ વિભાગના આ આકલનની પ્રતીક્ષા બેદૂતોએ કરી જ હશે. અને દર વર્ષે આ મોસમમાં કૃષિકારો સારી આગાહીની આશા અવશ્ય રાખે છે. મોસમ વિભાગે તો સામાન્યથી વધુ સારા ચોમાસાની આશા રાખી છે. એટલે કે ૧૦૪થી ૧૧૦ ટકા વરસાદ થશે. દેશની અર્થ વ્યવસ્થામાં કૃષિનું યોગદાન કોઈનાથી છૂપું રહ્યું નથી. સારો વરસાદ તો પાક પણ સારો રહેશે. જેનાથી અર્થ વ્યવસ્થામાં આજે પણ જીવન ઉપાર્જન માટે કૃષિ સૌથી મોટો આશરો છે. ઓછા વરસાદની સ્થિતિમાં સરકારોએ અરબો-ખરબો રૂપિયા દુષ્કાળ રાહત પર ખર્ચવા પડે છે. મોસમ વિભાગની આ ભવિષ્યવાણી ખુશીની તકો આપે છે. પરંતુ સાથોસાથ એક નવી જવાબદારી પણ આપે છે, સરકારો, સામાજિક સંગઠનોને અને સામાન્ય લોકોની પણ જવાબદારી એવી છે કે, પાણી પેદા નથી કરી શકતું ફક્ત તે સંગ્રહિત કરાય છે. પ્રકૃતિ મોસમના રૂપમાં આપણી ઉપર મહેરબાન હોય છે તે આપણી પણ જવાબદારી બને છે. કે આપણે એનું સારી રીતે સ્વાગત કરીએ. પાણી વર્થ વેડફંડ જોઈએ

નહીં વર્ષા જળને સંગ્રહિત કરવામાં પણ પોતાની ભાગીદારી નોંધાવશે.

દેશ આજાદીનો અમૃત મહોત્સવ મનાવી ચૂક્યો છે. હવે દેશની સામે નવા પડકારો આવ્યા છે. કહે છે કે જળ વિના જીવન સૂનું! સરકારોની સાથે રાજ્યનીતિક પક્ષો અને જનપ્રતિનિધિઓની ભૂમિકા આ મુદ્દા પર વધારે વધી જાય છે. જો બધા મળીને નિશ્ચય કરે તો વરસાદી જળના એક એક બુંદને બચાવીને ભવિષ્યને સોનેરી બનાવી શકાય છે. આ માટે દરેકની પોતાની જવાબદારી બને છે, એટલે દરેક નાગરિક જળ સંચય માટે કટિબદ્ધ બને.

(અનુ. પાના નં. ૨૮ નું ચાલુ)

વાડી બનતી હોય છે. આ બધું થવું જ જોઈએ પણ સાથે જળસંચયનું કામ પણ કરવું જોઈએ. ગીગાસણમાં થયું તેવું જળસંચયનું કામ જો દરેક ગામમાં થવા લાગે તો ખેતીને તો લાભ થશે પણ સાથે પ્રકૃતિને પારાવાર લાભ થશે.

આપણા વડીલો એવું કહેતા કે વાવવા તો આંબા વાવવા, જેનાં ફળ આવનારી પેઢી પણ ખાઈ શકે. ગીગાસણ ગામના લોકોએ પણ જળસંચયનું આ કામ કરીને આંબા જ વાવ્યા છે. જેનાં ફળ આવનારી પેઢીઓને મળશે. ગીગાસણ ગામના લોકોએ સાથે મળીને ‘જળ સંચય’ અને ‘આત્મનિર્ભરતા’નું ઉત્કૃષ્ટ ઉદાહરણ રજૂ કર્યું છે.

જળસ્ત્રોત

વિવેકપૂર્ણ ઉપયોગ દ્વારા વિશાળ જળ ભંડારનું નિર્માણ

વિશ્વ એક તરફ વૈશ્વિક શાંતિ, ન્યાય અને સુરક્ષા મામલે આગળ વધી રહ્યું છે ત્યારે વિશ્વ સમક્ષ જે તાકીદની સમસ્યા છે તે જળ સંકટનો ખતરો મંડરાઈ રહ્યો છે. જળ અછત સામાજિક-આર્થિક વૃદ્ધિને અસર કરે છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના વૈશ્વિક ખતરો-૨૦૧૬ના અહેવાલમાં વિશ્વ પર જે ૧૦ જોખમ મંડરાઈ રહ્યાં છે તેમાં ગ્રીજા નંબરના ખતરા તરીકે પાણીની કટોકટી કે જળતંગીનો ઉલ્લેખ કરાયો છે. તાજેતરના વર્લ્ડ બેંકના રિપોર્ટમાં એ બાબતનો સ્વીકાર કરાયો હતો કે જળવાયુ પરિવર્તનના કારણે જળસંબંધિત આધાતો વધશે અને આમ પણ પાણીના વપરાશમાં માંગ વધી રહ્યાંનું વલણ જોવા મળી રહ્યું છે.

એક અંદાજ છે કે વિશ્વની કુલ વસ્તીનાં બે તૃતીયાંશ લોકો અથવા તો ૪ બિલિયન લોકો દર વર્ષે એક મહિનો પાણીની તંગીનો સામનો કરે છે. પાણીની તંગીને કારણે ઉત્પાદકતામાં ઘટાડો થઈ શકે અને પાક નિર્ઝળ જઈ શકે તે અનાજની તરફ દોરી જાય અને તેના કારણે ભાવવધારો થાય તથા પરિણામે ભૂખમરો ફેલાઈ શકે.

ઇન્ડિયા ખુરાના

યુઅનના જાણાવ્યા પ્રમાણે ૨૦૫૦માં ૯ બિલિયન અથવા વધુની વસ્તીના ખોરાકને પહોંચી વળવા માટે ખોરાકની ઉત્પાદકતા ૬૦ ટકા હોવી અનિવાર્ય છે. અત્યારે ઉત્પાદન માટે ઊર્જા અને પાણીની જરૂર રહે છે જે ધર્ષણા પડકારો સર્જે છે. જોકે ૨૦૩૦ સુધીમાં વિશ્વએ ૪૦ ટકા પાણીની તંગી માટે સામનો કરવા તૈયાર રહેવું પડશે. કૃષિક્ષેત્રમાં વૈશ્વિક રીતે ૭૦ ટકા તાજા પાણીનો ઉપયોગ થાય છે અને વિશ્વમાં તાજા પાણીની તંગી માટેના જે કારણો છે તેમાંનું એક મુખ્ય કારણ આ પણ છે. વૈશ્વિક રીતે જોઈએ તો સિંચાઈ માટે જે પાણીની જરૂર છે તેમાં ૨૦૫૦ સુધીમાં ૬ ટકાનો વધારો થવાની આપેક્ષા છે.

સપ્ટેમ્બર, ૨૦૧૫માં સંયુક્ત રાષ્ટ્ર સંધિ (યુઅનઓ)એ ટકાઉ વિકાસ - ૨૦૩૦નો જે એજન્યા સ્વીકાર્યો તેમાં ૧૭ કેટલા ટકાઉ વિકાસ લક્ષ્યાંકોનો (એસડીજી)નો સમાવેશ થાય છે. લક્ષ્ય-૬ એટલે કે છઢા કમાંકના લક્ષ્યાંકમાં તમામ માટે પાણી અને સ્વચ્છતાનો સમાવેશ થાય છે.

ભારતના સંદર્ભમાં જોઈએ તો આ લક્ષ્યાંકને સિદ્ધ કરવું મુશ્કેલ છતાં શક્ય બની શકે જો કેટલાક પગલાં જેમ બને તેમ વહેલી

૪૦ ગ્રામસ્વરાજ

તકે લેવામાં આવે તો.

ભારતની વર્તમાન જળ કટોકટી

ભારતમાં ૨૦૧૬માં પાણીની સમસ્યા કેવી હતી તેના પર એક ઉત્તી નજર આ મુજબ છે :

ભારતના કુલ જિલ્લાઓમાંથી એક તૃત્યાંશ એટલે કે ગ્રીજા ભાગના જિલ્લાઓ ગંભીર દુષ્કાળથી પ્રભાવિત છે. ૧૦ રાજ્યોમાં ૨૫૮ જિલ્લાઓમાં ઉત્ત કરોડ લોકોને અસર થઈ છે.

માર્ચ-૨૦૧૬માં મહત્વના એવા ૮૧ જણાશયોમાં માત્ર ૨૪ ટકા જ પાણીનો જથ્થો હતો.

જાન્યુઆરી ૨૦૧૫થી ૨૦૧૬ સુધીમાં એકલા કાર્યાટકમાં ભીષણ દુષ્કાળ અને દેવાને કારણે અંદાજે એક હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી છે..

ગુજરાતમાં આઠ જિલ્લાના અંદાજે એક હજાર ગામોમાં પીવાના પાણીની તીવ્ર તંગી સર્જાઈ છે.

મહારાષ્ટ્રના પશ્ચિમ ભાગમાં મિરજથી ટ્રેનના ટેન્કરો દ્વારા દુષ્કાળગ્રસ્ત લાતુરને પાણીનો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે. પાણી રમખાણો ફાટી નિકળતા અટકાવવા જળસોતની નજીકમાં લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચોમાસુ આવે ત્યાં સુધીમાં કૂવા કે જાહેર જળવિતરણ સ્થળે પાંચ કે તેથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મૂકાયો છે.

મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના બુંદેલખંડ જિલ્લાઓ સતત ગ્રીજા વર્ષે દુષ્કાળનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં અંદાજે ૫૦ ટકા જળસોત સૂકાઈ ગયા છે. પીવાનું પાણી મેળવવા માટે મહિલાઓને દૂર દૂર સુધી ચાલવું પડે છે. કૃષિ નિષ્ઠળ ગઈ છે અને તેના કારણે મોટા પાયે હિજરત થઈ છે, ગરીબી અને ભૂખમરામાં વધારો થયો છે.

બુંદેલખંડના તિકમગઢ નગરપાલિકાના પ્રમુખે નજીકના ઉત્તરપ્રદેશથી આવતા પાણીના જથ્થાની ખેડૂતો દ્વારા થતી પાણી ચોરીને રોકવા હથિયારધારી પોલીસ મૂકી છે કેમ કે તીકમગઢ માટે પીવાના પાણીનો આ જ એક માત્ર સોત છે.

હૈદરાબાદ શહેરને પાણી પૂરું પાડનાર ચાર મોટા જણાશયો સૂકાઈ ગયા છે.

ગીરીમથક સિમલામાં પાણીની અત્યંત વિકટ તંગી સર્જાઈ છે એટલું જ નહીં પણ પ્રદૂષિત પાણીને કારણે કમળાનો રોગચાળો ફેલાયો છે. સત્તાવાળાઓ અંદાજ મૂકે છે કે રોજના ૧૪ મિલિયન લિટરની પાણીની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. જે શહેરની ૮૦થી ૮૫ ટકા વસ્તીને અસર કરે છે.

મહારાષ્ટ્રના પૂણેમાં પાણીની વધતી જતી માંગને પહોંચી વળવા માટે ટેન્કરો દ્વારા સરકાર પાણી પુરવઠો આપી રહી છે.

એવા પણ અહેવાલો છે કે પાણીની તંગીને કારણે ઔદ્યોગિક એકમો બંધ કરવા પડ્યા છે.

તજોલા નામના ઔદ્યોગિક શહેરમાં સમાહમાં બે દિવસ ઉત્પાદન બંધ રાખવામાં

ગ્રામસ્વરાજ

આવ્યું છે. આ શહેરમાં ૨૦થી ૭૦ ટકા એકમો એવા છે કે જેમની પાણીની ખૂબ મોટી માત્રાની જરૂર પડતી હોય છે જેમ કે ખાતર, રસાયણ, દવાઓ, ખોરાક અને ઠંડા પીણાં તથા ધાતુ બનાવવાના ઉદ્યોગો છે.

મહારાષ્ટ્રના સોલાપુર અને મરાઠાવાડમાં શેરડી પીલવાની ૧૩ જેટલી ખાંડ મિલો બંધ કરવામાં આવી છે. પાણીનો કામ મૂકવામાં આવ્યા બાદ કાપડ ઉદ્યોગ અને ડાઈગ કારખાનાઓમાં ઉત્પાદન બંધ રાખવામાં આવે છે.

પશ્ચિમ બંગાળમાં પાણીની તંગીને કારણે ફરક્કામાં વીજઉત્પાદન ખોરવાઈ ગયું છે.

રાજ્યોમાં આ રીતે પાણીની તંગીને કારણે પાક નિષ્ફળ, ફરજિયાત સ્થળાંતર, આપધાત, મૃત્યુ અને આરોગ્ય સેવા કેન્દ્રો તથા ઉદ્યોગો બંધ કરવાની ફરજ પડી છે. પાણીની તંગીને કારણે મહિલાઓ અને બાળકોના આરોગ્ય ઉપર પણ અસર થઈ છે. એક એવો દેશ કે જેમાં, (એ) ૧૪ મોટી, પંચાવન મધ્યમ અને ૭૦૦ નાની નદીઓ છે. (બી) સરેરાશ વાર્ષિક વરસાદ ૧૧૭૦ મીલિમીટર છે. (સી) દેશભરમાં વરસાદી પાણીના સંગ્રહની પરંપરા છે તેવા દેશમાં આ જળસંકટ નિવારી શકાયું હોત. જે પ્રશ્ન છે તે વાસ્તવિક જળતંગીને બદલે જળ ગેરવ્યવસ્થાપનને કારણે છે.

પરંપરાનું પુનઃ સ્થાપનઃ જળખાવનું સર્જન

સામૂહિક, સધન અને ટકાઉ સાતત્યપૂર્ણ પ્રયાસો દુષ્કાળને દેશવટો આપી શકે છે અને

જળનો પ્રચુર વિશાળ સમૃધ્ય ભંડાર સર્જ શકે તેમ છે. એટલું જ નહીં જળવાયુ પરિવર્તનને કારણો જે પડકારો ઉદ્ભવે છે તેને નિવારવામાં પણ મદદ કરી શકે છે. પરંતુ આ ત્યારે જ થાય કે જ્યારે તેમાં હિત ધરાવતા તમામ લોકો એકબીજાને સહયોગ આપે.

જળવ્યવસ્થાપન માટે પ્રથમ પગલું એ છે કે લોકો અને પાણી વચ્ચેના સંબંધોની પુનઃસ્થાપના માટે સર્વગ્રાહી સાતત્યપૂર્ણ અને સતત સધન જૂબેશ અનિવાર્ય છે. આ પ્રકારના પ્રયાસો તમામ હિતધારકોમાં એવી લાગણી સર્જશે કે જળ એક અપર્યાત્મિક ખૂટી જાય તેવો સ્વોત છે. જળસંરક્ષણ પ્રવૃત્તિઓ માટે પ્રથમ પૂર્વશરત એ છે કે સમાજમાં જાગરૂકતા લાવવી પડશે. તેનો એક અર્થ એવો થઈ શકે કે લોકોએ જળવ્યવસ્થાપનની કામગીરી પોતાના હાથમાં લેવી પડશે અને તે કાર્યને સમર્પિત થવું પડશે.

પાણીનો વિશાળ ભંડાર બનાવવા માટેની ચળવળ હાથ ધરવા ઘણા મોરચે ટૂંકા અને લાંબા ગાળાનાં પગલાં લેવા પડે તેમ છે. તેમાં જળ બંક જેવી સંપત્તિનું સર્જન કરવું, માંગ ઘટાડવી, પાણીનો બહુહેતુક ઉપયોગ અને ટીપેટીપાંનો ઉપયોગ તથા જળ બચાવવા જળ સંગ્રહ માટે નાવિન્યપૂર્ણ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે. તેમાંથી કેટલાક આ મુજબ છે :

તાકીદનાં પગલાં

આ પ્રકારનાં પગલાંઓ પાણીની તાકીદની સમસ્યા હલ કરવા માટે મહત્વનાં છે અને તેમાં નીચે મુજબનો સમાવેશ થાય છે :

ग्रामस्वराज

૧. ગામડાઓમાં દુષ્કાળ આપત્તિ રહે અને તેમનું આરોગ્ય થતું વેચાણ પણ સમિતિઓની રચના કરવી : આ ગ્રામીણ અટકાવી શકાશે.

સમિતિમાં ગામના પંચાયત સર્વ્યો અને રસ ધરાવતા જૂથના સર્વ્યોનો સમાવેશ થવો જોઈએ. આ સમિતિ દુષ્કાળ વખતે જરૂર પડતી ચીજવસ્તુઓ, વ્યવસ્થાપન વગેરેની કાળજી લેશે અને તેનું નિરીક્ષણ કરશે.

૨. આત્મહત્યા રોકવા બાબ્ય સમર્પણા :
આ પ્રકારની પરિસ્થિતિમાં નિરાશ - હતાશ
થયેલા ગામવાસીઓમાં એવો સંદેશો અને એવી
લાગણી પેદા થવી જોઈએ કે તેઓ આ
આપત્તિમાં એકલા નથી તથા સૌસુહૃત્તમાં એવી
પ્રતિજ્ઞા લે કે ગમે તે થાય પરંતુ તેઓ
આત્મહત્યાનું પગલું નહીં ભરે.

**ઢ. જ્યાં પીવાના પાણીની તંગી હોય ત્યાં
ટેન્કરની વ્યવસ્થા કરવી :** ગામવાસીઓને તેમાં
સામેલ કરવા અને પાણી પીવાલાયક છે તેની
ખાતરી કરીને ગામમાં તમામને પાણીનો જથ્થો
મળે તેવું આયોજન કરવું. પીવાના પાણી પુરવઠા
અને સ્વચ્છતા મંત્રાલયમાં દુષ્કાળ જેવી ગંભીર
પરિસ્થિતિ માટેની જોગવાઈ હોય છે અને તેનો
ઉપયોગ કરવો જોઈએ.

૪. ઢોરવાડામાં પશુઓ માટે પાણી અને ધાસચારાની વ્યવસ્થા કરવી : દુષ્કાળ જેવી સ્થિતિમાં જે મ કે (બુંદેલખંડ પ્રદેશ, રાજસ્થાનમાં) લોકો પોતાના પશુઓનું નિભાવ કરી ન શકતા કાં તો તેમને વેચી મારે છે અથવા તો તેમને તરછોડી દે છે. આ પ્રકારના રાહત કેમ્પોમાં પશુઓ માટે જરૂરી ધાસચારો મળી

રહે અને તેમનું આડેધ થતું વેચાડા પણ
અટકવી શકાશે.

પ. અશના અધિકારનો અમલ
 (આરટીએફ) : જાહેર વિતરણ વ્યવસ્થા
 (પીડીએસ) અને આરટીએફ હેઠળના અન્ય
 કાર્યક્રમોનું મૂલ્યાંકન કરવું તથા અસરગ્રસ્તો
 માટે અનુ પુરવઠો ભળી રહે તેવી ચોક્કસતા
 રાખવી. અને ફરીથી કહી શકાય કે આ
 સુપ્રિમકોર્ટનો હુકમ છે.

૬. જળસંરક્ષણ માળખા રચવા બનાવવા
 કે તેની પુનઃસ્થાપના કરવી : ગામવાસીઓને
 એવો સંદેશો પહોંચાડો કે વરસાદના પાણીનું
 એક એક ટીપું કે જે જમીન પર પડે છે, ઘર
 પર પડે છે ગામ કે પંચાયતમાં પડે છે તે વ્યર્થ
 જવું ના જોઈએ. આ ચોમાસામાં તો જળસંગ્રહ
 થવો જ જોઈએ એવી કેટલીક બાબતો છે કે
 જે થઈ શકે તેમ છે. દાખલા તરીકે....

A. ખેડૂતો તેમના ખેતરમાં મેટ્બંધી
 (ખેતરની ફરતે દિવાલ બનાવવી) કરી શકે
 જેથી વરસાદનું પાણી સંગ્રહી શકાય. વરસાદના
 પાણીને ઝીલવા માટે નાનકડો ખાડો પણ કરી
 શકાય, ખેતરમાં જળસંગ્રહ માટેના કૂવાઓ
 ચોખ્ખા કરવા જોઈએ જેથી વરસાદના ચોખ્ખા
 પાણીનો સંગ્રહ કરી શકાય.

B. લગભગ દરેક ગામમાં જળાશય, ટાંકા, તળાવ કે કૂવા કે જળસંગ્રહ માટેના અન્ય માળખા હોય જ છે. ગામ સમિતિ આ માળખા કઈ હાલતમાં તેનું અવલોકન કરી શકે અને જો યોગ્ય હાલતમાં ન હોય તો તેનું સમારકામ

ગ્રામસ્વરાજ

કરી શકે, કાંપ ઉલેચી નાખે વગેરેની કામગીરી હાથ ધરી શકે. વરસાદી પાણીના તમામ નાણા, પ્રવાહો કે નદીઓનું રક્ષણ થાય અને રિચાર્જ તરીકે તેનો ઉપયોગ થાય.

C. વરસાઈ પાણીના સંરક્ષણ માટે નવા માળખા જેમ કે તળાવો વગેરેનું નિર્માણ થઈ શકે. ચોમાસાનું આગમન થાય પછી તે અગત્યનું છે. કે વરસાઈ પાણી ક્યાં વહે છે, ક્યાં એકત્ર થાય છે તેની જાણકારી રાખે જેથી ભવિષ્યમાં જ્યારે જળસંગ્રહ માટેના માળખા બનાવવાની જરૂર પડે ત્યારે તેમાં તેનો ઉપયોગ થઈ શકે. મનરેગા યોજનામાં ફાળવાતું બજેટ જળ સંગ્રહ, જળસંરક્ષણ માળખાની રચના માટે પણ વપરાય તેવું આયોજન થવું જોઈએ. આ ઉપરાંત ગામવાસીઓના હાથમાં નાણાંની સરળ અને સીધી વહેંચણી થવી જોઈએ જે સુપ્રિમકોર્ટનો આ અંગેનો એક ચૂકાદો પણ છે. સાંસદોને ફાળવાતી ગ્રાન્ટ અને અન્ય સરકારી ગ્રાન્ટનો પણ જળસંગ્રહ માટે ઉપયોગ થવો જોઈએ.

લાંબાગાળાનાં પગલાં

લાંબાગાળાનાં પગલાં જળ સંપત્તિ વિકાસ
માટે જરૂરી છે. જોકે તેમાં વિગતવાર આયોજન
અને નાગાડીય ફાળવણી કરવી પડે છતાં આ
કાળે કઠીન નથી. ભારતને એક આશીર્વાદ
મળ્યા છે કે વાર્ષિક વરસાદ સરેરાશ ૧૧૦૦
મી.મી. જેટલો છે. અને મોટાભાગનો વરસાદ
૧૦૦ કલાકમાં પડી જાય છે. પાણીના આ
પ્રાથમિક સ્થોતનો એક યા બીજી રીતે ઉપયોગ

કે સંગ્રહ થવો જોઈએ. ભૂગર્ભ જળના રિચાર્જ માટે અને સપાટી પરના જળની શુદ્ધતા માટે ઉપયોગ થવો જોઈએ. જો વરસાદી પાણીનું યોગ્ય બ્યવસ્થાપન ના થાય તો ચોમાસા દરમ્યાન પૂર આવે છે અને તે પછીના મહિનાઓમાં પાણીની તંગી સર્જય છે.

વરસાદી પાણીને તેના પ્રાકૃતિક જળચકમાં
પરત મૂકવું એટલે તેનો અર્થ એ કે તેને એકત્ર
કરો, સાફ કરો, રાખી મૂકો અને તેને મુક્ત
કરો અર્થાત્ તેને પ્રાકૃતિક અવસ્થામાં સહજ
રીતે પુનઃ મૂકી શકાય. ભારતના દરેક પ્રદેશમાં
જળસંગ્રહણી પોતાની આગવી પરંપરા છે કે
જે જે તે પ્રદેશને અનુકૂળ હોય છે તેથી તેને
મોટા પાયે પુનઃ સજીવન કે લોકભોગ્ય બનાવવી
જોઈએ. આ પ્રકારના નમૂનાઓને ચકાસીને,
અમલમાં મુકીને કે વર્તમાન જરૂરિયાત મુજબ
તેમાં ફેરફાર કરી શકાય. સમગ્ર દેશમાં જોઈએ
તો એવા અનેક દાખલાઓ જોવા મળશે કે
જ્યાં સમાજે, સમૂહે સાથે મળીને જળનું સંરક્ષણ
કર્યું હોય. કૃષિ ક્ષેત્રો કેટલોક સમય તેનો અમલ
કરીને આ એવો પ્રયાસ છે કે દુષ્કાળ એક
કરતાં વધુ વર્ષ સુધી રહે તો પણ તેવા સંકટના
વર્ષોમાં જળની કોઈ તંગી ના રહે.

જણસંગ્રહના દેશવ્યાપી સમૂહ પ્રયાસો

હુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં રહેતા
સમાજસમૂહો દ્વારા પાણી બચાવવા, જળ
વ્યવસ્થાપન અને જળ પુનઃ પ્રાપ્તિના ઉપાયો
તરફ ફાળો આપ્યો છે. કેટલાક દાખલાઓ
નીચે મુજબ છે :

ग्रामस्वराज

ਦੁ਷ਕਾਣਗਰਸਤ ਬੁਂਡੇਲਖੜਿਮਾਂ ਨਾਗਰਿਕ
 ਸਾਮਾਜਿਕ ਸੰਸਥਾ - ਪਰਮਾਰਥ ਫ਼ਾਰਾ ਦੁ਷ਕਾਣਗਰਸਤ
 ਲੋਕੋਨੇ ਪ੍ਰਾਚਿਕ ਵਗਰ ਮਹਿਸੂਸ ਕੀਤੇ ਜਿਮਾਂ ਦੁ਷ਕਾਣਨੁੰ
 ਜੋਖਮ ਘਟਾਉ ਤੇਵੁਂ ਆਯੋਜਨ ਕਰ੍ਯੂ, ਵਰਸਾਈ
 ਪਾਣੀਨੁੰ ਸੰਭਾਣ ਕਰ੍ਯੂ ਅਨੇ ਸਮਾਜ ਤਥਾ ਸੰਸਥਾ
 ਵਚ੍ਚੇ ਕਿਸੀ ਜੋਤਵਾਨੁੰ ਕਾਮ ਕਰ੍ਯੂ ਛੇ. ਜਲ ਸਹੇਲੀ
 (ਜਲਨੀ ਸਖੀ) ਨਾਮਨੀ ਧੋਜਨਾ ਗਾਮਡਾਂਓਮਾਂ
 ਪਾਣੀ ਪੁਰਵਠਾ ਤਥਾ ਪਾਣੀਨਾ ਸੱਗ੍ਰਹਣਾ ਪ੍ਰਯਾਸੋ
 ਤਰੀਕੇ ਅਮਲਮਾਂ ਮੁਕਵਾਮਾਂ ਆਵੀ ਛੇ.

આંધ્રપ્રદેશ ખેડૂત સંચાલિત ભૂગર્ભ જળ
પદ્ધતિ (એપીએફએમ જીએસ) હેઠળ
આંધ્રપ્રદેશના દુષ્કાળગ્રસ્ત સાત જિલ્લામાં
યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેમાં
ખેડૂતો પોતાના ખેતરમાં ભૂગર્ભજળનું સંચાલન
જાતે કરે છે તથા કૃષિપાકમાં પણ યોગ્ય વિકલ્પો
અપનાવ્યા. દ્વિ.

૨૦૦૨માં ગુજરાતના હુઝાળગ્રસ્ત
રાજસમદ્વિયાળા ગામમાં ખેત તલાવડી,
અનુશ્રવણ તળાવ ચેકડેમ અને પેટા સપાટી
માળખાને કારણે વર્ષમાં ત્રણ ત્રણ પાક લેવામાં
આવ્યો હતો

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના
હિવારે બજાર ગામમાં જળ વ્યવસ્થાપનની એવી
સર્વગ્રાહી પદ્ધતિ અપનાવવામાં આવી કે જ્યાં
ગામવાસીઓએ જાતે શ્રમજીવીની ભૂમિકા
ભજવી હતી, વાર્ષિક જળ બજેટ-૨૦૦૪ના
નામે નવતર જળપ્રયોગ કરી બતાવ્યો હતો.

રાજસ્થાનના હુદ્ગાળગ્રસ્ત સેપોરિયા ગામમાં વરસાદી પાણી માટે અંગેડ પદ્ધતિ

અમલમાં મૂકાઈ જેને ડક સિસ્ટમ અથવા ચૌકા
તરીકે ઓળખવામાં આવે છે જેમાં વરસાદનું
પાણી જીલવામાં આવે છે તથા પીવાના પાણીની
ઉપલબ્ધતામાં સંધારો જોવા મળ્યો હતો.

ਕੁਤ੍ਰਿਮ ਭੂਗਲਪੁਰਾ ਰਿਚਾਰਡ ਵਾਰਾ
ਪੇਟਾਸਪਾਟੀ ਜ਼ਿਲ੍ਹ ਵਿਵਸਥਾਨੁੰ ਸੰਗ੍ਰਹਣ :

ભૂગર્ભજળને રિચાર્જ કરવાની ટકાવારી ઓછામાં ઓછી બમણી હોવી જરૂરી છે. અને તે કુદરતી પ્રક્રિયા અને વરસાદી પાણીને કૃત્રિમ ભૂગર્ભ જળ શુદ્ધિકરણ તરફ લઈ જઈને સરળતાથી મેળવી શકાય તેમ છે. વરસાદી પાણીનો સંગ્રહ અને કૃત્રિમ ભૂગર્ભ જળ રિચાર્જ બે હેતુ સિદ્ધ કરે છે : વધારાનું પાણી શોષ્ણી લે છે અને જ્યારે જરૂર હોય ત્યારે પાણી આપે છે. આજે જ્યારે ખુલ્લી જમીન ઘટી રહી છે ખાસ કરીને શહેરી વિસ્તારોમાં ત્યારે મોટાપાયે કૃત્રિમ રિચાર્જ જળસંકટને નિવારવામાં મદદ કરી શકે, પૂરની શક્યતા ઘટાડી શકે અને પાણીની ગુણવત્તામાં સુધારો કરી શકે તેમ છે.

કૂત્રિમ ભૂગર્ભ જળ રિચાર્જ એ છીધરા
પાણીમાં સપાટી જળનું શુદ્ધિકરણ કરે છે (અ)
પેટાસપાટી પર પાણીના જથ્થામાં વધારો કરે
છે. અને (બી) પ્રાકૃતિક ધ્યાન આપવાની
પ્રક્રિયાઓને કારણે તેની ગુણવત્તામાં સુધારો
થાય છે. નદી ખીણ પ્રદેશ અને મેદાની
વિસ્તારોમાં નદી કે તળાવના પાણીને છીધરા
રેતી અને ગ્રેવલ સ્તરોમાંથી પસાર કરીને
જળશુદ્ધિકરણ થાય છે. આ પદ્ધતિમાં પાણીને
પાઈસ. કુવાઓ અને બેઝીનમાંથી પસાર કરીને

ग्रामस्वराज

શુદ્ધ કરી શકાય.

સપાઠી પરના કુવાનું કૃતિમ રીતે
જલજારમાં પ્રવેશ કરવાથી ગુણવત્તાયુક્ત અને
જથ્થાબંધ કાયદાઓ મળે છે :

નદીના ઘૂસેલા પાણીનું પ્રદૂષણ કે કયરો
કુદરતી પ્રક્રિયાથી ઘટે છે. કૃત્રિમ ભૂગર્ભ
જળપવેશથી સારું જળ વ્યવસ્થાપન જોવા મળે
છે કેમ કે નદી અને ભૂગર્ભ જલભર વચ્ચે
પાણીનું સ્તર નદીમાંથી ક્યારે ઓછું કે વધારે
જથ્થો છોડવામાં આવ્યો તે વચ્ચેની ગણતરી
થઈ શકે. સમય જતાં નદી અને જલજારની
વચ્ચે પાણીના સંતુલનને કારણે વર્ષ દરમ્યાન
પાણીનો જથ્થો મળવાપાત્ર બને છે, જેનાથી
સમગ્ર વર્ષ દરમ્યાન સતત પાણી મેળવવાની
ક્ષમતા સર્જય છે. સામાન્ય રીતે, કૃત્રિમ રીતે
રિચાર્જ કરેલ ભૂગર્ભજળ સપાટી જળ કરતાં
વધુ સલામત હોય છે કેમ કે તેને પ્રદૂષણથી
રક્ષિત કરી શકાય છે. જ્યારે સપાટી પરના
જળને એવું રક્ષણ મળતું નથી. એટલું જ નહીં
પણ જળ સુરક્ષા ઝોનના સિમાંકનને તે સલામત
બનાવે છે. નદીના પૂર જળ રિચાર્જની મોટી
તક પૂરી પાડે છે. સમય જતાં, સપાટી અને
ભૂગર્ભ જળ વચ્ચેનું સંતુલન નદીઓ માટે
લાભદાયી નિવડણે અને નદીઓ સમગ્ર વર્ષ
દરમ્યાન વહેશે તથા ભૂગર્ભજળ પણ રિચાર્જ
થશે. દિલ્હી જલબોર્ડ દ્વારા અમલમાં મુકાયેલ
પાલવા ફલડવોટર રિચાર્જ આવું જ એક શ્રેષ્ઠ
ઉદાહરણ છે.

જો તેને મોટાપાયે અમલી બનાવાય તો
વ્યાપક પ્રમાણમાં પાણીની બચત થઈ શકે તેમ

છે. પાણીના વ્યાપક સંગ્રહ માટે કૃત્રિમ જળસંગ્રહ જગ્યા જેમ કે તેમ બનાવવા માટે પર્યાવરણીય, નાણાકીય અને સામાજિક મુદ્દાઓ સંકળાયેલા હોય છે ત્યારે ભૂગર્ભ જળ જલભરનું રિચાર્જિંગ એક સ્વભાવિક પસંદગી છે. કૃત્રિમ રિચાર્જ આમ પ્રયંક શક્તિ ધરાવે છે.

જો વરસાદી પાણીના સંરક્ષણની કામગીરી ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં નાના નાના એકમોથી લઈને પ્રદેશ કક્ષા સુધી હાથ ધરવામાં આવે તો તે આશાનું કારણ બની શકે છે.

જળસંરક્ષણ માટે ક્ષેત્રિય અભિગમો
કેટલાક એવા પગલાંઓ કે જે કુષિ ક્ષેત્ર
દ્વારા લઈ શકાય કેમ કે કુષિ ક્ષેત્ર પાણીનો
સૌથી વધુ વપરાશ કરનાર ક્ષેત્ર છે.

三

કૃષિ ક્ષેત્રએ જળસંબંધિત અનેક બાબતોનો
ઉકેલ લાવવો જ રહ્યો, જળ વપરાશમાં ઓછી
કાર્યક્ષમતા - ઉચ્ચથી ૪૦ ટકા નહેર આધ્યારિત
સિંચાઈ અને ૬૦ ટકા ભૂગર્ભ જળસિંચાઈ
યોજના, પાણીની ઉપલબ્ધતાનો ઈકાર, વસ્તી
વધતા ખોરાક - અન્નની માંગમાં વધારો,
બદલાતી જતી ખાવાની ટેવો, આરટીએફ
હેઠળના સંકલ્પો અને પાણી માટે સ્પર્ધાત્મક
માંગ વગેરે. એવું અનુમાન છે કે સિંચાઈ માટે
પાણીની માંગ સમય જતાં વધશે. કૃષિમાં
પાણીના વધતા વપરાશ અંગે કેટલાક વિકલ્પો
આ મુજબ છે :

A. ઉપલબ્ધ પાણી હોય તેનાથી જ પાક

લઈ શકાય તે બાબતને પ્રોત્સાહન
કુષિપાકોમાં શેરડી અને ડાંગર માટે મોટા

૪૦ ગ્રામસ્વરાજ

પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. આ પ્રકારના પાકો ત્યાં જ લેવા જોઈએ કે જ્યાં પાણીની ઉપલબ્ધતા પૂરતા પ્રમાણમાં હોય. સ્થાનિક પાક વિવિધતા માટે પ્રોત્સાહન આપવું જોઈએ અને લઘુતમ ભાવ કે બજાર અને બજાર પદ્ધતિ તે માટે વિકસિત કરવી જોઈએ.

B. સૂક્ષ્મ સિંચાઈ અપનાવવી (અેમઆઈ)

ટપક અને હુવારા સિંચાઈ પદ્ધતિ પાણીનો વપરાશ ઘટાડે છે તથા ૪૦થી ૮૦ ટકા જેટલો પાણીનો વપરાશ ઘટાડે છે. સિંચાઈ માટેની પદ્ધતિઓ જેવી કે તેનો સમયપત્રક, વાવણી, ખેતર ખેડું, પાક લેવો, ખાતર નાખવું વગેરેમાં ફેરફારથી પાણીની બચત થઈ શકે છે. પાક સારો થાય છે અને ઉત્પાદકતામાં વધારો થાય છે.

C. જમીન અને જળ વ્યવસ્થાપન પ્રયોગો

આ બાબતોમાં સર્વગ્રાહી વ્યવહારોનો સમાવેશ થાય જેમ કે જમીન - પાણી સંરક્ષણ, પાક માટે પૂરતી જમીનની તૈયારીઓ, વરસાદી પાણીનો સંગ્રહ, કૃષિના નકામા પાણીનો પુનઃઉપયોગ, પાણીના પ્રવેશ માટે વાવણી સંરક્ષણ, નકામા વહી જતાં પાણીનો બગાડ અટકાવવો અને જમીનમાં બેજ જળવાઈ રહે તેવા પ્રયાસોનો સમાવેશ થાય છે.

D. જમીન સમતળ કરવી

આ પ્રકારની પદ્ધતિથી જમીન જે ઉભડખાબડ હોય તે સમતળ થાય છે અને સમતળને કારણે પાક ઊભો થાય છે. તેનાથી પાકની ઉત્પાદકતામાં વધારો થાય છે. તેનાથી

૨૦થી ૩૦ ટકા વધારે ઉત્પાદન મળી શકે તેમ છે.

E. ડાંગરની વાવણી પદ્ધતિ (અેસઆરઆઈ)

અેસઆરઆઈ પદ્ધતિ એક એવી પદ્ધતિ છે કે જેનાથી પાણીની જરૂરિયાત ડાંગરના પાક માટે ૨૮ ટકા ઘટી જાય છે અને ૮થી ૧૨ દિવસમાં પાક વૃદ્ધિ થાય છે જેનાથી ડાંગરની ઉત્પાદકતામાં વધારો થાય છે. આ પ્રકારની ટેકનોલોજી શેરડીના વાવેતર માટે પણ ઉપયોગી નિવડી શકે તેમ છે.

ઉદ્યોગો

ભારતની જીડીપીમાં ઉદ્યોગોનો મહત્વનો ફાળો છે અને ઔદ્યોગિક ક્ષેત્રના વિસ્તારની સાથે પાણીની માંગમાં પણ વધારો થાય છે. ઉદ્યોગો દ્વારા વપરાશમાં લેવાતા પાણીનો ગેરઉપયોગ થાય છે. જળ પ્રદૂષણની સમસ્યા સર્જય છે અને તેનાથી જળસંકટ તથા પાણીની હલકી ગુણવત્તા સર્જય છે.

તેમાં ફેરફારની શરૂઆત કરીએ તો ઉદ્યોગો દ્વારા જે પાણીનો વપરાશ થાય છે તેમાં બદલાવ લાવવો પડે, આ બદલાવ એ પ્રકારનો કે પાણી ખૂબ સસ્તુ છે અને બહોળા પ્રમાણમાં મળે છે એવી માન્યતામાં સુધારો થવો જોઈએ કે પાણીનો ઉપયોગ કરનારામાં સ્પર્ધા છે અને માનવીના મૂળભૂત અધિકાર પર અસર કરે છે. પાણી આધ્યારિત ઉદ્યોગો પાણી માટે સ્થાનિક ખેડૂતો, નાગરિકો અને અન્યો સાથે સ્પર્ધા કરે છે.

ગ્રામસ્વરાજ

સદનસીબે, પાણી એક અપયોગિત કે ખૂટી જાય તેવું સ્વોત છે અને તેની પ્રાપ્તિમાં જોખમ રહેલું છે તેવા પ્રચારથી કંપનીઓ ઉત્પાદન પ્રક્રિયામાં વપરાતા પાણીના વપરાશમાં ઘટાડો કરે. કંપનીઓ તેમના જળસ્વોત કે જળવપરાશમાં ઘટાડો કરવા તૈયાર છે અને તે માટે પાણીના સ્વોત પ્રત્યેની તેમની જવાબદારીપૂર્વકની વર્તણૂક અને ઉત્પાદનને પ્રમાણિત કરવું પડે. ઉદ્યોગો સામેના કેટલાક વિકલ્પો ? આ મુજબ છે :

A. જળ કાર્યક્રમતામાં વધારો

પાણીની કાર્યક્રમતામાં વધારો થવાથી પાણીની માંગમાં ઘટાડો થશે. જો પદ્ધતિસરનો અભિગમ અપનાવવામાં આવે તો ઔદ્યોગિક એકમોમાં ૨૫થી ૫૦ ટકા પાણીનો બગાડ અટકી શકે, એવી કેટલીક પદ્ધતિઓ કે જેનાથી પાણીનો વપરાશ ઘટી શકે તેમાં ઉત્પાદકતા કે ટેકનોલોજીમાં ફેરફાર કરી શકાય. જેમ કે વોટર કુલિંગથી લઈને એર કુલિંગની પદ્ધતિમાં ફેરફારો થઈ શકે. પાણી આધારિત ઉપકરણો કે અન્ય સામગ્રીમાં ફેરફાર થઈ શકે. નકામા જતા પાણીનો પુનઃઉપયોગ કરવો અને ઔદ્યોગિક ઉપયોગ માટે તેનો ફરીથી ઉપયોગ તથા વરસાદી પાણીનો સંગ્રહ કરીને પાણી મેળવી શકે.

B. જીવનચક્ર પૃથક્કરણ

જીવનચક્ર વિશ્લેષક પર્યાવરણીય અસરોનું મૂલ્યાંકન કરવામાં મદદ કરી શકે. આ પર્યાવરણીય અસરો ઉત્પાદનના જીવનના વિવિધ તબક્કા જેમ કે ઉત્પાદનથી લઈને છેવટે

કચરાના ઢગલામાં જવાના તબક્કાનું પૃથક્કરણ થઈ શકે. જેમાં કાચામાલથી લઈને તેને બનાવવાની, વિતરણની, ઉપયોગની સમારકામની અને જાળવણી તથા છેવટે તેના નિકાલની બાબતનો સમાવેશ થાય છે.

ઉત્પાદન શરૂ કરવા માટેના પ્રમાણપત્રક મેળવવાથી લઈને અન્ય તમામ પ્રક્રિયાઓમાં એ બાબતનો ઉત્ખેખ થવો જોઈએ કે પાણીની વિશેષ જરૂર કેટલી પડશે. આ પ્રકારના પ્રમાણપત્રના એક ભાગ તરીકે પાણી મહત્વનું અંગ હોવાથી ઉદ્યોગોને એવા પગલાં લેવાની જરૂર પડશે કે ઉદ્યોગોમાં વપરાતા પાણીની ઉદ્ભવતા કે પદ્ધતિને ઉત્પાદન પ્રક્રિયા વખતે અને વપરાશકાર સુધી પહોંચાડવાની સમગ્ર સાંકળ સુધરશે ઉપરાંત તે ઉદ્યોગો જ્યાં આવેલા છે તેની પરિસ્થિતિ વિષયક પદ્ધતિને પણ સુધારશે. ઉદ્યોગો પાણીની જરૂરિયાત અને વપરાશના ધોરણો અપનાવે તેમાં પાંચ સ્તર રહેલા છે જેમાં પાયાનું કાસ્ય, ૨૪ત, સુવર્ણ અને ખેટીનિયમનો સમાવેશ થાય છે.

C. પુરવઠા સાંકળ જળવ્યવસ્થાપન

કંપનીઓ તેમના માલ ઉત્પાદનને છેવટના વપરાશકાર સુધી પહોંચાડવાની પુરવઠા વિતરણ સાંકળમાં અસરકારક જળવ્યવસ્થાપનની વ્યૂહરચના બનાવી રહી છે. જેમ કે એચ. એન્ડ એમ. કંપનીએ ડબલ્યુ. ડબલ્યુ. એફ. સાથેની ભાગીદારીમાં જળ વ્યવસ્થાપનના સંભોસ્થાપન છે જેમાં માલસામાનની રૂપરેખા અને તૈયારીઓ માટે પાણીની ઉપલબ્ધતા કર્યાં કેવી

ગ્રામસ્વરાજ

ઇ તથા ઉત્પાદનમાં તેની કેટલી જરૂર પડશે વગેરેની તાલીમ આપવામાં આવે છે. કંપનીની પોતાની સુવિધામાં પાણીની બચત કર્ય રીતે થાય તે બાબતો અલગ તારવવામાં આવે છે, સ્થાનિક અને સરકાર તથા હિતધારકો સાથે કામ કરવું, વધુ સારા જળવ્યવસ્થાપન માટે એનજીઓ અને અન્ય કંપનીઓ સાથે કામ કરવું ખાસ કરીને ચીન અને બાંગલાદેશમાં નદી આધારિત ઉદ્યોગો આ પ્રણાલિને અપનાવી રહ્યાં છે. ઉપરાંત ઉપભોક્તાને પણ જળ વ્યવસ્થાપન અંગે શિક્ષણ આપવામાં આવે છે.

D. જળ ઓફ સેટ

એવી સ્થિતિ કે જેમાં જળ વપરાશ કાર્યક્ષમ પદ્ધતિ છતાં ઘટાડી શકાય તેમ નથી તેવી સ્થિતિમાં પાણીનો પુનઃ ઉપયોગ કે પુનઃ ચક વોટર ઓફસેટ મૂડીરોકાણથી લઈને જળખાવની પદ્ધતિ અપનાવવી જોઈએ. જળ ઓફસેટ અપનાવવાથી નવા વૃક્ષોનું વાવેતર થશે કે પછી જમીનની ગુણવત્તામાં રોકાણ કરવું પડે. જેનો છેવટે લાભ તો જે તે કંપનીને જ થાય.

ઉપસંહાર

જળ વપરાશ અને જળ બચતમાં લોકોને એ વલાણ તરફ લઈ જવું શક્ય છે અને તે દ્વારા ભારતને જળસમૃદ્ધ રાષ્ટ્ર બનાવી શકાય તેમ છે. સૂચનોનો ભંડાર કે જે ઉપર મુજબ દર્શાવવામાં આવ્યા છે તેમાંથી કેટલાક સૂચનોનો અમલ થઈ શક્યો છે. બાબત એ નથી કે ભારત કેટલો વરસાદ મેળવે છે બાબત એ છે કે આ તમામ પ્રયાસો કરીને ભારત વરસાઈ પાણીનો

જથ્થો કેટલો મેળવી શકે છે અને તાકીદના તથા ભવિષ્યના ઉપયોગ માટે કેટલો સંગ્રહ થઈ શકે છે.

(સૌજન્ય : યોજના, જુલાઈ-૨૦૧૬)

(અનુ. પાના નં. ઉ નું ચાલુ) જળ એ જ... જાગૃત કરવા માટે અભિયાન ચલાવવામાં આવે છે. પ્રધાનમંત્રી સિંચાઈ યોજના આ પ્રકારનો એક કાર્યક્રમ છે. વરસાદના પાણીનું સંરક્ષણ અને પૂરના પાણીનું વ્યવસ્થાપન જેવી જળ સંરક્ષણ પદ્ધતિઓ સમગ્ર દેશમાં મોટા પાયે પ્રસ્તુત કરવામાં આવી છે, જેથી જળ કટોકટીનું નિવારણ થઈ શકે. જ્યારે નદીઓનું આંતરજ્ઞેડાણ મોટા પાયે કેટલીક નદીઓના વધારાના પાણીથી અન્ય વિસ્તારોના નદીઓના સૂકો પટને ભરશે તેવી અપેક્ષા છે, ત્યારે મોટી નદીઓ પરના તેમ પૂર દરમિયાન વધારાના પાણીનો સંગ્રહ, સિંચાઈ, વીજ ઉત્પાદન અને વિવિધ હેતુઓ માટે કરી શકશે. નમામી ગંગે અને યમુના એક્ષણ ખાલાન જેવા પ્રોજેક્ટ સૂકી અને મૃતપ્રાય: નદીઓને નવજીવન આપશે તેવી સંભાવના છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ પરયે પ્રતિબદ્ધતા દાખવવાની અને યુદ્ધના ધોરણે કામ કરવાની જરૂર છે.

ગુજરાતીમાં કહેવાય છે કે “જળ એ જ જીવન છે” એટલે કે જો જળ છે તો જ આપણું ભવિષ્ય સલામત છે. જોકે આપણે કુદરતની આ કિમતી ભેટનો વિચાર કર્યા વિના દુરૂપ્યોગ કરી રહ્યા છીએ. અત્યારે દરેક જળયક અને જીવનયક એક જ એ બાબત સમજે તેની ઉચિત સમય છે. એટલે અત્યારથી ચાલો આપણે પાણીની એક એક બુંદ બચાવવાની શરૂઆત કરીએ.

પર્યાવરણ બચાવવા નાગરિકોમાં સર્વસંમતિ શા માટે જરૂરી ?

ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ' (ટીલોર) નામના પદ્ધીના અસ્તિત્વના મામલે દેશની સુપ્રિમ કોર્ટના તાજેતરના નિર્ણયમાં, આ પક્ષીને હવામાન પરિવર્તનની અસરોથી મુક્ત જીવન જીવવાને મૂળભૂત માનવ અધિકારનો દરજો આપવામાં આવ્યો છે. આ નિર્ણયથી નીતિ નિર્માતાઓ અને રિન્યુએબલ એન્જિનિયરિંગ સિસ્ટમ્સ વિકસાવનારા ઉત્પાદકોને આશ્રય થયું છે. તેઓ કહે છે કે ન્યાયાધીશો, વૈજ્ઞાનિક નિષ્ણાતોની સલાહની અવગાણના કરી રહ્યા છે અને આનાથી કલાઈમેટ ચેન્જનો પડકાર જીલવામાં મિકેનિકલ સ્થાપનામાં વિલંબ થશે. કોર્ટ સ્વીકૃતું છે કે આબોહવા પરિવર્તન અનિશ્ચિન્નિય વિસ્તારોમાં પણ ન્યાયશાસ્ત્રની દખલ તરફ દોરી રહ્યું છે. આબોહવા પરિવર્તનની અસરોથી સર્જયેલી અસ્તિત્વની કટોકટી મૂડીવાદી અર્થતંત્ર અને અયોગ્ય વિજ્ઞાનના વર્તમાન આદર્શો દ્વારા સારી રીતે સમજીને એને ઉકેલવાના પ્રયાસો થવા જોઈએ.

વાસ્તવમાં મૂડીવાદી અર્થતંત્રમાં, કુદરતી સંપત્તિ તેના માલિકની મૂડી છે. રાજીઓ અને જમીનદારો આ જમીનના માલિક છે અને તેમના વિસ્તારના તમામ જળચર, જંગલ અને મત્સ્ય સંસાધનો, પ્રાણીઓ અને પક્ષીઓ તેમની

મિલકતા છે. તેઓ તેમની જમીન પર રહેતા અને કામ કરતા નોકરો અથવા ગુલામો દ્વારા ઉત્પાદિત ઉત્પાદન અથવા ઉત્પાદનની પણ માલિકી ધરાવે છે.

જે માલિકો તેમની માલિકીની જમીન પર ઘરો બાંધે છે અને લોકો સાથે વાતચીત કરે છે, જ્યાં તેમના નોકરો મહેનત કરે છે. તેઓ તેમની દેખરેખ હેઠળ જંગલો અને પાકનો વિકાસ પોતાને માટે જોઈ શકે છે. પરંતુ અન્યત્ર રહેતા મકાનમાલિકોને તેની પડી નથી. તેઓને માત્ર નફાની જ ચિંતા હોય છે, જમીન દુષ્કાળ હોય કે પૂરગ્રસ્ત હોય, ન તો તેઓને નોકરોની મુશ્કેલીઓની ચિંતા હોય છે. કોમોડિટી બજારોનો ઉદ્ભવ, જ્યાં પ્રાણીઓ લાવવામાં આવે છે, ખેતરોમાં ઊગાડવામાં આવે છે, લાકું અને ખનિજો વગેરે, વેપારીઓ દ્વારા નાણાંના વિનિમય દ્વારા નિયત ભાવે ખરીદે છે અને વેચે છે, તે કુદરતી મૂડીને નાણાકીય મૂડીમાં રૂપાંતરિત કરવાનો એક માર્ગ છે. નાણાકીય બજારોએ મૂડીવાદીઓનો એક નવો વર્ગ ઉભો કર્યો છે, જેમને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા જમીનમાલિકો કરતાં જમીની વાસ્તવિકતાઓનું ઓછું જ્ઞાન છે. તેઓ કોષ્ટકો (ચાર્ટે) અથવા

❖ ❖ ❖ ❖ ❖ ❖ ❖ • ગ્રામસ્વરાજ • ❖ ❖ ❖ ❖ ❖ ❖ ❖

દેટા પરથી વિશ્વની સ્થિતિનું મૂલ્યાંકન કરે છે તે સામાન્ય લોકો માટે ખરાબ ?

અને તે જોવા માટે કે બજારો અને શેરબજારોમાં કઈ કોમોડિટી અથવા શેરની કિંમત વધી કે ઘટી છે? જ્યારે કોઈ વ્યક્તિ ગ્રામ્ય વિસ્તાર છોડીને ફેકટરીઓમાં મજૂર તરીકે કામ કરવાનું શરૂ કરે છે, ત્યારે તેનું વેતન કામ કરેલા કલાકો અને આ સમયગાળા દરમિયાન દર્શાવવામાં આવે છે. કારખાનાના માલિક માટે, તેનું કૌશલ્ય અને શ્રમ પણ માત્ર ખરીદવા યોગ્ય વસ્તુ છે. અર્થશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્રમાં, મિલકતનો અવિકાર પ્રાચીન સમયથી એક અવિકાર છે. માનવાધિકારની માન્યતા ઘણી પાછળથી આવી. ઉદ્દેશ્ય ગુલામીનો અંત લાવવા, વાજબી વેતન મેળવવા અને સલામત કાર્યકારી વાતાવરણ ઊભું કરવાનો હતો. ‘ગીગ વર્ક’ પ્રણાલી એ ૨૧મી સદીની શ્રમ બનાવવાની રીત છે, જેમાં ૪૩૨ પડે ત્યારે ૪ કામદારોની સેવાઓ લેવામાં આવે છે, કરેલા કામ માટે ૪ વેતન ચૂકવવામાં આવે છે અને અન્ય કોઈ પ્રકારની સામાજિક સુરક્ષા તેમાં હોતી નથી જેમ કે તેમને વધારાની સુખ સુવિધા આપવી, પેન્શન આપવું, પીએફની સમાન રકમ જમા કરાવવી એવી કોઈ સુવિધા આ ગીગી વર્કરોને મળતી નથી. તેથી તેનો સ્વાદ સારો છે પરંતુ ગેરેટ હાર્ડિનનો ‘ટ્રેજેરી ઓફ ધ કોમન્સ’ નામનો સિદ્ધાંત ખાનગીકરણની વિચારધારાને રેખાંકિત કરે છે. આ વિચાર અથવા સિદ્ધાંતમાં, જાહેર સંપત્તિની સંભાળ લેવાની જવાબદારી કોઈ લેતું નથી. તેથી, જાહેર અને સામાન્ય મિલકત ખાનગી હાથોને સોંપી દેવી જોઈએ, જેઓ વધુ નફો કમાવવાની ઈચ્છાથી પ્રેરાઈને, તેમના સંબંધિત શેરોનું સંચાલન સારી રીતે કરશે. વૈશ્વિક પર્યાવરણને થતા નુકસાન, જે બધા દ્વારા વહેંચાયેલું છે, તે હવે એક વૈશ્વિક કટોકટી બની ગયું છે. અસ્ક્યામતોના વધુ ખાનગીકરણ દ્વારા આનો ઉકેલ લાવી શકાતો નથી. ‘વૈશ્વિક ભાગીદારીનું વચન’ના ધ્યેયને હાંસલ કરવા માટે મેનેજમેન્ટના નવા સિદ્ધાંતોની આજે જરૂર છે. ૧૭મી સદીમાં યુરોપીયન એનલાઈટનમેન્ટના જન્મ પર કષ્યું કે વિજ્ઞાન હવે માણસને બેકાબૂ પ્રકૃતિને નિયંત્રિત કરવાની શક્તિ આપશે. ભૌતિક શાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાનની નવીનતમ શોધોએ માણસના ભૌતિક લાભ માટે પૃથ્વીની સંપત્તિનું શોખણ કરવા માટે શક્તિશાળી સાધનો પૂરાં પાડ્યા છે, જે તકનીકી રીતે અધતન રાષ્ટ્રીના નાગરિકોના ઉચ્ચ જીવન ધોરણને બાકીના લોકોની ઈર્ઝા બનાવે છે.

મુન્દ

જગ છે તો જીવન છે... નજ છે, કુવો છે, પણ પાણી નથી

એશિયામાં લગભગ ૮૦ ટકા વસતિ જળ
સંકટનો સામનો કરી રહી છે. ભારત અને
પાકિસ્તાન પર સૌથી વધુ ખતરો છે. યુઅન
રિપોર્ટના એડિટર - ઈન- ચીફ જણાવ્યું હતું
કે, “ પાણી માનવતા માટે લોહી જેવું છે.
તે લોકોનાં અસ્તિત્વ, આરોગ્ય, વિકાસ માટે
જરૂરી છે. આ સમય એક સાથે આવવાનો
અને પગલાં લેવાનો છે.

વિશ્વની ૨૬ ટકા વસતિને પીવા માટે
શુદ્ધ પાણી મળતું નથી, જ્યારે ૪૬ ટકા વસતિ
સુરક્ષિત પીવાના પાણીનો લાભ લઈ રહી છે.
યુએન વતી યુનેસ્કો દ્વારા બહાર પાડવામાં

આવેલા એક અહેવાલ મુજબ, વિશ્વમાં બેથી ત્રણ અબજ લોકોને વર્ષમાં ઓછામાં ઓછા એક મહિના સુધી પાણીની અછતનો સામનો કરે છે. આગામી સમયમાં આ સંકટ વધુ ઘેરું બનશે. હડીકત એ છે કે ભારત ભીખણા જળસંકટનો સામનો કરી રહ્યું છે. આ વર્ષે અલ નિનો ચ્યક ચોમાસા પર અસર કરશે.

પાણીની જરૂરિયાત અને ઉપલબ્ધતા વચ્ચેનું અંતર સતત વધી રહ્યું છે.

વિશ્વ બેન્કે પણ કહું હતું કે, ‘ભારતમાં ઉનાળો આવતા જ પાણી સોનાની જેમ કિંમતી વસ્તુ બની જાય છે. વિશ્વની ૧૮ ટકા વસતિ અને માત્ર ચાર ટકા જળ સંસાધનો ધરાવતું ભારત વિશ્વમાં સૌથી વધુ જળ સંકટ ધરાવતા દેશોમાંનો એક છે. તાજેતરમાં સંસદમાં માહિતી આપવામાં આવી હતી કે પ્રતિ વ્યક્તિ પાણીની ઉપલબ્ધતા ૨૦૩૧ સુધી ૧,૪૮૬ કયુબિક મીટરથી ઘટીને ૧,૩૬૭ કયુબિક મીટર થઈ જશે.

જો કે સરકારની હર ઘર જલ 'યોજનાથી પ્રગતિ થઈ છે. ઓગસ્ટ ૨૦૧૮થી ૮.૨ કરોડ ગ્રામીણ પરિવારોને નળથી જળ પૂરું પાડવામાં આવ્યું છે. ઇતાં હજુ ઘણું કરવાનું બાકી છે. ૧૦માંથી ૪ ઘરોમાં હજુ પણ નળનાં જોડાણ ઉપલબ્ધ નથી. માર્ચ, ૨૦૨૩ સુધીનો સંસંદનો રેકૉર્ડ જણાવે છે કે પશ્ચિમ બંગાળમાં ૬૮ ટકા, આરબંડમાં ૬૭ ટકા, ઉત્તરપ્રદેશમાં ૬૬ ટકા, છતીસગઢમાં ૬૦ ટકા અને રાજ્યસ્થાનમાં ૬૩ ટકા ઘરોમાં નળનાં જોડાણો નથી.

દેશના શહેરો પીવાના પાણી માટે બોટલ
અને ટેન્કર પર આધારિત છે. ટેન્કરો દ્વારા

ડૉ. કિશોર સાધુ
પ્રકાશન અધિકારી
ગુજરાત રાજ્ય સહકારી સંધુ
અમદાવાદ - ૧

ગ્રામસ્વરાજ

જળ પુરવઠા માટે ભૂ - જળ પર આધાર રાખવો પડે છે. જળ સંસાધનો અંગે સંસદની સ્થાયી સમિતિએ તેનાં લેટેસ્ટ રિપોર્ટમાં સ્પષ્ટતા કરી છે કે ભૂ - જળ ભારતનાં ગ્રામીણ વિસ્તારોમાં ૮૦ ટકા અને શહેરી વિસ્તારોમાં ૫૦ ટકા અને સિંચાઈ વિસ્તારોમાં લગભગ બે તૃતીયાંશ હિસ્સો ધરાવે છે. છેલ્લાં ચાર દાયકામાં સિંચાઈમાં કુલ વૃદ્ધિનો લગભગ ૮૪ ટકા હિસ્સો ભૂ-જળમાંથી આવ્યો છે.

ભારતમાં કૃષિ સંશોધન માટેનું બજેટ કૃષિ જીવીપીના માત્ર ૦.૪૮ ટકા છે, જે દક્ષિણ આફિકામાં ૨.૮ ટકા અને બ્રાઝિલમાં ૧.૮ ટકાની સરખામણીમાં ધાણું ઓછું છે. જુલાઈ, ૨૦૧૫માં સરકારે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત દરેક ખેતરને પાણી ‘યોજના શરૂ કરી હતી. ગ્રામીણ વિકાસ અંગેની સ્થાયી સમિતિનો અહેવાલ કહે છે વર્ષ ૨૦૨૨-૨૩માં આ યોજના માટેની ફાળવણી રૂ. ૧૬૮૭ કરોડથી ઘટાડીને રૂ. ૮૬૮ કરોડ કરવામાં આવી હતી. જેમાંથી જાન્યુઆરી ૨૦૨૩ સુધીમાં માત્ર રૂ. ૪૧૪ કરોડ જ ખર્ચ કરવામાં આવ્યા હતા.

જળ સંકટનાં ઉકેલ માટે એ મુદ્દે પણ વિચારવાની જરૂર છે કે પાણીનો ઉપયોગ કર્દી રીતે કરવામાં આવે. ભારત વરસાદી પાણીનાં એક તૃતીયાંશ હિસ્સાનો ઉપયોગ કરી શકે છે. વરસાદ ચાર મહિના માટે હોય છે, જ્યારે પાણીની જરૂરિયાત તો બારે માસ હોય નદીઓને પરસ્પર જોડવાનો વિચાર ખૂબ સારો

છે. પણ રાજકીય અને આર્થિક કારણોસર તેમાં ખાસ પ્રગતિ નથી સાધવામાં આવી. આકડાઓ આપીને યોજનાઓને સફળ બતાવવામાં આવે છે પણ અમલીકરણમાં અનેક ખામીઓ છે. સમગ્ર વિશ્વમાં તાજા પાણીનાં ઓત સુકાઈ રહ્યા છે.

ગરમ અને શુષ્ણ વિસ્તારોમાં વધતી વસતિ બને ઉચ્ચા જીવન ધોરણને કારણે પૂરતું પાણી નથી મળી રહ્યું. જળવાયુ પરિવર્તને સ્થિતિને વધુ કપરી બનાવી દીધી છે કે ‘આઈસબર્ગ હાર્વેસ્ટિંગ’ (વાદળ અને બરફની ખેતી) ? જળ પુરવઠા માટે પૂરતી નથી. વળી આ નવતર પદ્ધતિઓનો અત્યંત મર્યાદિત ઉપયોગ થાય છે. આ સ્થિતિમાં સમુદ્રના ખારા પાણીમાંથી મીઠું દૂર કરીને તેને પીવા લાયક બનાવવામાં આવે તો દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડી શકાય પણ આ પ્રક્રિયામાં ઊર્જાનો વધુ વપરાશ થાય છે અને પર્યાવરણની રીતે પણ તે નુકસાનકારક છે.

સમુદ્રના પાણીમાંથી મીઠાને અલગ કરવાની સદીઓ જૂની પદ્ધતિ અંતર્ગત ‘થર્મલ ડિસ્ટિલેશન’ અથવા રિવર્સ ઓસ્મોસિસ મેથ્રેનનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ટેકનોલોજીનો ઉપયોગ વિશ્વતરમાં થઈ રહ્યો છે. ૧૭૦થી વધુ દેશોમાં ૨૦,૦૦૦થી વધુ ઉસેલીનેશન ચન્ટ લગાવવામાં આવ્યા છે. સૌથી મોટા ૧૦ ખાન્ટ સાઉદી અરેબિયા, યુએઈ અને ઈર્જરાયેલામાં સ્થાપવામાં આવ્યા છે.

❖ ❖ ❖ ❖ ❖ ❖ ❖ • ગ્રામસ્વરાજ • ❖ ❖ ❖ ❖ ❖ ❖ ❖

સંયુક્ત રાષ્ટ્રની જળ, પર્યાવરણ અને આરોગ્ય સંબંધિત સંસ્થાના ડેઝુટી ડાયરેક્ટર મંજૂર કાદિર તેમના અહેવાલમાં લખ્યું છે કે વિશ્વનું આશરે ૪૭ ટકા મીઠારહિત પાણી (ડિસેલિનેટેડ વોટર) મધ્યપૂર્વ અને ઉત્તર આંકિકામાં તૈયાર કરવામાં આવે છે. આ વિસ્તારોમાં પ્રતિ વ્યક્તિ ૫૦૦ ઘન મીટરથી પણ ઓછું પાણી વરસાદ કે નદીઓ દ્વારા મળે છે. તેની સરખામણીમાં અમેરિકામાં પ્રતિ વ્યક્તિ ૧૨૦૭ ઘન મીટર પાણી ઉપલબ્ધ છે. પાણીની તંગી હજુ ઘેરી બનવાની છે, ત્યારે વૈજ્ઞાનિકો સમુદ્રનાં ડિસેલિનેશનની વાતો કરી રહ્યા છે અને તેનો ખર્ચ ખોછો થાય તે દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે.

વર્ષ ૨૦૦૦નાં દાયકામાં આ ખર્ચ પ્રતી ઘન મીટર (૧૦૦૦ લિટર) પાંચ ડોલર હતો, જેને ઘટાડીને ૫૦ સેન્ટ પર લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. યુરોપિય સંઘમાં સૌથી ગરમ અને સૌથી સૂક્ષ્મ પ્રદેશ સાઈપ્રેસે પીવાના પાણીની ૮૦ ટકા જરૂરિયાત પૂરી કરવા ડિસેલિનેશન પર આધાર રાખવો પડે છે. ત્યાં ૧૯૯૦નાં દાયકાથી જ પાણી અંગેના પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. જો કે આ પ્રક્રિયાની મોટી આડાસર પર્યાવરણને નુકસાન છે. ડિસેલિનેશન પ્રક્રિયામાં વધુ ઊજાનો ખર્ચ થાય છે. સાયપ્રસમાં ડિસેલિનેશનની પર્યાવરણ પર અસર અંગે ૨૦૨૧માં કરવામાં આવેલા સર્વે પ્રમાણે દેશમાં કુલ ઉત્સર્જનમાં બે ટકા શ્રીન

હાઉસ ગેસ ઉત્સર્જન વર્તમાન ચાર ખાન્ટમાંથી થાય છે. દેશનાં કુલ વીજ વપરાશમાં પાંચ ટકા હિસ્સો આ ખાન્ટનો છે.

આ પ્રક્રિયામાંથી ૧૦ કરોડ ઘન મીટર જેરી અને અત્યંત ખારું પાણી વહી જાય છે. તેની અસર ભૂમધ્ય સમુદ્રની ઈકો સિસ્ટમ પર પડે છે. આ ખારાપણું જળવાયુ પ્રેરિત તાપમાન વૃદ્ધિ સાથે મળવાથી ઓક્સિજનની માત્રાને ઓછી કરે છે. વૈશ્વિક સ્તરે પાણીનાં મુદ્દે સફળતાનાં ઘણા ઉદાહરણ છે. અનેક દેશો પાણીનાં રિસાઈકલિંગ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. સિંગાપોર તેનાં પાણીની જરૂરિયાતનો ૪૦ ટકા હિસ્સો રિસાઈકલિંગ દ્વારા પૂરો કરે છે. ભારતમાં પાણી બચાવવા અંગે પ્રયાસ થયા છે, છતાં લોકોમાં જોઈએ એટલી જાગૃતિનો અભાવ છે. ગામડાઓમાં જેતી માટે પાણી જમીનમાંથી જેંચી લેવાય છે. જ્યારે શહેરમાં ઘર વપરાશ માટે બોરવેલ ખોદાવી મબલખ પાણી ઊલેચી લેવાય છે પરંતુ હવે તો પાતાળકૂવા પણ ઢૂકી ગયા છે.

આપણી પૃથ્વી પર જેટલું પાણી છે એમાંનું ૮૭ ટકા મહાસાગરોના ખારા જળના રૂપમાં મોજૂદ છે. જે ત્રણ ટકા જેટલું મીઠું પાણી છે એમાંનું ૨.૫ ટકા જળ હિમનદીઓમાં બરફના સ્વરૂપમાં રહેલું છે. કુલ જથ્થાના ૦.૫ ટકા જેટલું પાણી જ આપણા માટે ઉપલબ્ધ છે. તાજા પાણીનો જેટલો જથ્થો ઉપલબ્ધ છે એમાંનો પણ મોટો ભાગ અમેરિકા અને કનેડાની સરહદ

❖ ❖ ❖ ❖ ❖ ❖ ❖ • ગ્રામસ્વરાજ • ❖ ❖ ❖ ❖ ❖ ❖ ❖

પર આવેલા મોટા-મોટાં તળાવોમાં રહેલો છે. બાકીની દુનિયામાં વધી રહેલી વસતિ, શહેરીકરણ, ઉદ્યોગીકરણ અને પ્રદૂષણને કારણે પાણીના પ્રાય જથ્થામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના એક હેવાલ મુજબ એશિયામાં માથાદીઠ પ્રતિવર્ષ ૩,૦૦૦ ઘનમીટર જેટલું પાણી જ લોકોને મળી શકે એમ છે. એમાં પણ ભારતની સરેરાશ ૨,૫૦૦ ઘનમીટરની જ છે. ઉત્તર ભારતમાં એવો રિવાજ છે કે કન્યા દ્વારા કુવાની પૂજા કરવામાં આવે ત્યાર બાદ જ લગ્નની વિધિ પૂરી થયેલી ગણાય. આજે મોટા ભાગના કુવા ભુરાઈ ગયા હોવાથી ઘણાં ગામોમાં કુવાને બદલે પાણીનાં ટેન્કરની જ પૂજા કરાવીને લગ્નની વિધિ આટોપી લેવામાં આવે છે. ભારતમાં લગભગ ૨૦ કરોડ લોકો એવા છે જેમને પીવા માટે ચોખ્ખું પાણી મળતું નથી. દેશમાં પીવાના પાણીના જેટલા સોત છે એ પૈકી ૮૦ ટકા સોત ઉદ્યોગો દ્વારા ઠાલવવામાં આવતા કચરાને કારણે કે ગટરનું ગંદું પાણી ભળવાને કારણે પ્રદૂષિત થઈ ગયા છે.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં વર્ષ દરમિયાન થતા વરસાદનો ૮૦ ટકા વરસાદ ચોમાસામાં થાય છે. તેમ છતાં દેશમાં થતા કુલ વરસાદનું માત્ર ૧૩ ટકા પાણી જ જમીનમાં ઉતરે છે ને બાકીનું વેડફાઈ જાય છે. આથી જમીનમાં પાણીના તળ સતત ઊંડા જતા જાય છે. આથી જ તો જે વિસ્તારમાં ચોમાસામાં પૂરની

પરિસ્થિતિ જોવા મળી હોય તે વિસ્તારો ઉનાળામાં તરસે મરે છે.

નાસાના વિજ્ઞાનીઓએ જણાવ્યું છે કે ઉત્તર ભારતના અનેક શહેરોમાં ભૂગર્ભ જળ દરવર્ષે એક કૂટ ઊંડા ઉત્તરી રહ્યા છે. અભ્યાસના તારણો અનુસાર પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને હિન્દુભીમાં વર્ષ ૨૦૦૮થી ૨૦૧૮ દરમિયાન ભૂગર્ભ જળનો ૧૨૦ ઘન કિલોમીટર જથ્થો અદશ્ય થઈ ગયો છે.

આ અંગે ચિંતા વ્યક્ત કરતા વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે ખાસ કરીને માનવ ગતિવિધિમાં થયેલા અભૂતપૂર્વ વધારાને કારણે આ સ્થિતિ પેદા થઈ છે. તેમણે ચેતવણી આપી હતી કે જો સમયસર પગલાં નહિ લેવામાં આવે તો ઉત્તર ભારતમાં કૃષિ ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થશે તથા પીવાના પાણીની પણ તંગી ઊભી થશે. અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા નાસાએ ઉપગ્રહ મારફતે મેળવેલી માહિતી નાસાની વેબસાઈટ પર પ્રકાશિત કરી છે.

આ તારણો ગ્રેવીટી રીકવરી એન્ડ કલાઇમેટ ચેઇન્જ એક્સપ્રીમેન્ટ (ગ્રેસ)ના નામે નાસાએ હાથ ધરેલા અભ્યાસ દ્વારા સાંપડ્યા હતા. ઉત્તર ભારતના આ પ્રદેશોની જેતી મોટાપાયે સિંચાઈ આધારિત છે, અને જો ભૂતળના જળને ટકાઉ બનાવવા માટે યોગ્ય પગલાં નહિ લેવામાં આવે તો પ્રદેશના લાખો લોકોને પીવાના પાણીની અધતનો સામનો કરવો પડશે? તથા કૃષિ ઉત્પાદનને માઠી અસર

૪૩

ગ્રામસ્વરાજ

થશે.

નાસાની હાઈડ્રોલોજિસ્ટની ટુકડીની મદદથી હાથ ધરેલા અભ્યાસને આધારે જણાવ્યું હતું કે પીવાની તથા વપરાશની જરૂરિયાત માટે મોટાપાયે પંપ દ્વારા પાણી ખેંચવામાં આવે છે. તેથી કુદરતી વ્યવસ્થા દ્વારા ભૂતળમાં પાણીનો જથ્થો વધે તેના કરતા પણ ઝડપથી જથ્થો ખાલી થઈ રહ્યો છે.

ગુજરાતમાં ભૂગર્ભજળની સ્થિતિ ચિંતાજનક છે કેમકે, રાજ્યના ૭૨ ટકા કૂવાઓમાં ભૂગર્ભજળ સ્તર કરતાં ૫ થી ૧૦ મીટર સુધી પાણી નીચે ઉત્થાપાયે છે. આ કારણોસર ગામડાઓમાં કૂવામાંથી ય પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે.

સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના એક રિપોર્ટ મુજબ, ગુજરાતના ૧૨૬૭ કૂવાઓ પરનું નિરીક્ષણ કરતાં એવી બાબત જાણવા મળી કે, કૂવાઓમાં પાણીનું સ્તર નીચે જઈ રહ્યું છે. તેનું કારણ એ છે કે, ભૂગર્ભજળનો ધૂમ વપરાશ થઈ રહ્યો છે. ટ્યુબવેલ થકી લોકો પાણીનો આદેહડ વપરાશ કરી રહ્યા છે. બોર બનાવવા પર કોઈ પ્રતિબંધ નથી. એટલું જ નહીં, કોઈ નિયમો સુધ્યાં નથી. વર્ષ ૨૦૧૬-૧૭ના વાર્ષિક રિપોર્ટમાં જણાવાયું છેકે, અમરેલી જૂનાગઢ, સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગર જિલ્લામાં કૂવાઓમાં પાણીનું સ્તર અત્યંત નીચે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છ

અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ય કૂવાઓની આ જ સ્થિતિ છે. ડાંગ, ભરૂચ, સુરત સહિત આદિવાસી વિસ્તારોમાં કૂવાઓમાં જળસ્તર ઘટ્યું છે.

ઉત્તર ગુજરાતમાં તો કૂવાઓમાં પાણીનું સ્તર છેક ૧૫૪થી માંડીને ૨૭૪ મીટર ઉંદી સુધી પહોંચ્યું છે. ભૂગર્ભજળ સ્તર કરતાય નીચે પાણી ઉત્થાપાયે છે. ગાંધીનગર જિલ્લાના ચરાડામાં કૂવાઓમાં સૌથી નીચે જળસ્તર જોવા મળ્યું છે. અહીં કૂવામાં, પાણીનું સ્તર ૧૮૪.૬ મીટર રહ્યું છે. સૌરાષ્ટ્રમાં ૮૧ ટકા કૂવાઓમાં પાણીનું સ્તર ભૂગર્ભજળ સ્તર કરતા ૨૦થી ૪૦ મીટર નીચે રહ્યું છે. અમરેલીના કેરાલામાં સૌથી ઓછુ ૩૫.૮૨ મીટર જળસ્તર કૂવામાં નોંધાયું છે. આ જ પ્રમાણે. કચ્છમાં ૮૮ ટકા કૂવાઓમાં આ જ સ્થિતી રહી છે. કચ્છમાં કોટડામાં સૌથી નીચે રહ્યું છે.

નિષ્ણાતોનું કહેવું છેકે, જો કૂવાઓનું વોટર રિચાર્જ નહીં કરાય અથવા તો વોટર હાર્વેસ્ટિંગ પદ્ધતિનો વધુને વધુ ઉપયોગ નહીં કરવામાં આવે તો કૂવાઓ ખાલીખમ થઈ જશે. કૂવાઓની હાલમાં જે સ્થિતિ છે તે જોતા લાગી રહ્યું છેકે, ગામડાઓમાં રહેતાં પરિવારો માટે આ લાલબત્તી છે. ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા વધુ ઘેરી બને તે દિવસો હવે દૂર રહ્યાં નથી. એક બેંકું પાણી મેળવવા લોકોને ઝૂમવું પડશે આવા કપરા કાળને રોકવા પાણીનો બગાડ

ग्रामस्वराज

ન થાય તે માટે લોકજાગૃતિ કેળવવી ય એટલી
જ જરૂર છે.

આગળ આપેલાં આંકડા સૂચવે છે કે
મસમોટા ખર્ચવાળી નર્મદા યોજનાનો હજુ
પર્યાત્મ લાભ ઉઠાવી શકાયો નથી. આમ થવા
પાછળનું મુખ્ય કારણ કેનાલોના અધૂરા-
અપૂરતા નેટવર્કનું છે. કેનાલોનાં અભાવે
સંગ્રહિત થતું પાણી ખેતરો સુધી પહોંચતું નથી.

બીજુ તરફ ભૂગર્ભજળ પર સિંચાઈનો
મોટો આધાર બની રહ્યો છે. ધરતીના પેટાઓમાં
પાણી ઉલેચાઈ રહ્યું છે અને તે ઉલેચવા માટે
વીજળીનો પણ વ્યાપક વપરાશ થઈ રહ્યો છે.
પાછલાં વર્ષોમાં ભૂગર્ભજળનો વપરાશ વધ્યાનું
વલાણ રહ્યું છે જે જોખમકારક છે. ચોમાસું થોડું
પણ નબળું જાય તો તેની પહેલી સીધી અસર
પાક વાવેતર અને ઉત્પાદન પર પડે છે અને
બીજુ અસર સિંચાઈ યોજનાઓનાં જળશયોમાં
સંગ્રહિત થતા જળરાશિ પર પડે છે.

આજે ગુજરાતમાં જમીનમાં જે પાણી છે તે પૈકીનું ૭૨ ટકા પાણી લોકોએ ઉલેચી નાંખ્યું છે. દેશમાં ૫૪ ટકા વિસ્તાર આજે એવો છે જ્યાં પીવાલાયક પાણી નથી. વોટરમેન તરીકે બિઝુદ મેળવનારાં રાજેન્ડરસિંહે એવી ચિંતા વ્યક્ત કરી છેકે, જો ભૂગર્ભજળના રિચાર્જ માટે કામ કરવામાં નહીં આવે તો, ગુજરાત માટે આવનારાં દિવસો માઠાં હશે.

ઓરિસ્સામાં હિરાકુંડા તેમ બંધાયો તેનો

હેતુ એ હતો કે પુરને અંકુશમાં લેવાય પણ આજેય પુર આવે છે. તેમો કે નદીઓથી પાણીની સમસ્યા હલ થઈ શકે નહીં. આજે દેશમાં ૫૪ ટકા વિસ્તારો એવા છે કે જ્યાં પાણી પીવાલાયક નથી. પાણીની અધિતમાં પ્રથમ કમાંકે તામિલનાડુ, બીજા કમે કર્ણાટક અને ત્રીજા કમે ગુજરાત છે. અંડરગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટ માટે કામ કરવું પડશે. એટલું જ નહીં. ભૂગર્ભજળના વપરાશ માટે પોલિસી પણ ઘડવી પડશે તો ગુજરાતની પાણીની ઘણીખરી સમસ્યા હલ થઈ શકે છે. ગુજરાતની મોટાભાગની નદીઓ પ્રદૂષિત છે. ઉદ્યોગોના કેમિકલયુક્ત પાણીને લીધે આ દશા થઈ છે.

આ સિવાય તામિલનાડુમાં કુવાના પાણીની સૌથી ખરાબ સ્થિતિ છે, જ્યાં પઉદમાંથી ૪૬૫ એટલે કે ૮૭% કુવાના પાણીમાં ઘટાડો થયો છે. ગુજરાતની વાત કરવામાં આવે તો સેન્ટ્રલ ગ્રાઉન્ડર વોટર બોર્ડ દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણ અનુસાર રાજ્યમાં કુલ ૭૮૮ કુવા છે. જેમાંથી ૫૮%ના પાણીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. નાસાએ ઉપગ્રહના ડેટાનો અભ્યાસ કરી દુનિયાભરમાં ક્યાં ક્યાં પાણીની તીવ્ર અછત સર્જાશે તેનો નકશો તૈયાર કર્યો છે. શુદ્ધ ભૂગર્ભજળની અછત જ્યાં સૌથી વધુ પડી રહી છે અને ભવિષ્યમાં પડવાની છે એવા સ્થળોમાં ભારતનો પણ સમાવેશ થયો છે. આ ઉપરાંત મિડલ ઈસ્ટ અમેરિકાનું

૪૩

ગ્રામસ્વરાજ

કેલિઝનિયા રાજ્ય અને ઓસ્ટ્રેલિયા એ ગ્રામ સ્થળોનું જળ પણ જડપથી ઉંડું ઉતરી રહ્યું છે.

ભારતમાં ભુગર્ભજળની અછતનું કારણ ખેતી પાક હોવાનું નાસાના રિપોર્ટમાં જણાવાયું છે. ભારતના ઉત્તર ભાગમાં વધારે અછત સર્જઈ રહી છે. ત્યાં મોટે પાયે ઘઉં અને ચોખાની ખેતી થાય છે. આ બને પાકમાં પુષ્કળ પાણીની જરૂર પડે છે. એટલે જમીનમાંથી મહત્તમ પાણી ખેંચી લેવાય છે. જોકે ફરીથી નોર્મલ વરસાદ પડે ત્યારે પાણી જમીનમાં ઉતરે છે, પણ તેનો જોઈએ એટલો સંગ્રહ થતો નથી. આખી દુનિયામાં પાણીનું મેનેજમેન્ટ નબળી રીતે થઈ રહ્યું છે, જે જળ અછતનું સૌથી મોટું કારણ છે.

માત્ર જૂજ યુરોપિયન દેશો જ શુદ્ધ જળના અભાવથી બચી શક્યો છે. આ રીતે સેટેલાઈટનો ઉપયોગ કરીને જળમાપનની પ્રવૃત્તિ નાસા દ્વારા પ્રથમવાર કરવામાં આવી છે. આ રિપોર્ટ પ્રમાણે જ્યાં આજે પાણી છે, ત્યાં જમીનમાં પાણીનું સર ઘટી રહ્યું છે, જે વિસ્તાર સુક્કા છે એ વધુ સુક્કા બની રહ્યાં છે.

નાસાના રિપોર્ટ પ્રમાણે આ સદીના અંત સુધીમાં પાણીની અછત એ આખા જગતની સૌથી મોટી સમસ્યા બની જશે. કેમ કે ૩૪ સ્પોટ પૈકી ૧૮ સ્થળ એવા છે કે, જ્યાં પાણી સતત નીચું ઉતરી રહ્યું છે. આ રિપોર્ટ દ્વારા

પહેલી વખત ખબર પડી કે જ્યાં પુરતો વરસાદ પડે એવા ઘણા સ્થળોએ પણ ભૂગર્ભજળ તળીયે જઈ રહ્યું છે. કાસ્પિયન સમુદ્ર આખો નાનો થતો જાય છે, કેમ કે તેમાં જળ ઠાલવતી નદીઓના પાણીને રસ્તામાં જ આંતરી લેવામાં આવે છે. એ વિસ્તારમાં જ આવેલો અરાલ સમુદ્ર તો તેનું ૮૦ ટકા જળ કયારનો ગુમાવી ચૂક્યો છે અને જ્યાં થોડા વર્ષો પહેલા સમુદ્રના મોઝાં ઉછળતા હતા ત્યાં હવે રેતીના મેદાનો છે.

એક સંશોધન મુજબ પાણીના વપરાશ અને વોટર રીચાર્જનું સમતોલન જાળવવા માટે વરસાદનું ૩૧ ટકા પાણી જમીનમાં ઉત્તરવું જોઈએ. કુમાઉ વિશ્વ વિધાલયના નેચરલ રિસોર્સ ડાટા મેનેજમેન્ટ સિસ્ટમના સ્ટડી મુજબ જંગલ અને હિમાલયન વિસ્તારોમાં પણ વોટર રિચાર્જની સ્થિતિ સારી નથી. જમીનમાંથી જેટલું પાણી ઉલેચવામાં આવે છે તેટલું પાણી જમીનમાં ઉત્તરવાની રીચાર્જ પ્રક્રિયા કરવામાં આવતી નથી. આ રીચાર્જમાં એક બે ટકા ઓછા વત્તા પ્રમાણમાં હોય તો ચાલી શકે પરંતુ કુમાઉ વિસ્તારમાં થયેલા એક અભ્યાસ મુજબ ચીડના વન વિસ્તારમાં ૧૩ ટકા, વાંસના જંગલોમાં ૨૩ ટકા કૂષિલાયક જમીનમાં ૧૮ ટકા, બંજર જમીનમાં ૫ ટકા અને શહેરી વિસ્તારોમાં માત્ર ૩ ટકા પાણી રિચાર્જ થાય છે.

એક માહિતી મુજબ જંગલ અને પહાડી

❖ ❖ ❖ ❖ ❖ ❖ ❖ • ગ્રામસ્વરાજ • ❖ ❖ ❖ ❖ ❖ ❖ ❖

વિસ્તારો કરતા મેદાની શહેરી વિસ્તારોની - કમોસમી વરસાદ વરસશે. પાણી માટે લોકો પરિસ્થિતિ તો આના કરતા પણ ગંભીર છે. લાયાર બની જશે.

પાકા ડામર રોડ અને સિમેન્ટ, કોંકિટના બાંધકામના પરીણામે શહેરોના ભૂતળમાં વરસાદનું પાણી જતું જ નથી. આથી પાણીના તળ વધુને વધુ ઉંડા જઈ રહ્યા છે. શહેરી વિસ્તારોમાં માંડ બે ટકા જેટલું પાણી જમીનમાં ઉતરે છે. આથી ડિજિટલ ઈન્જિયામાં વોટર કાઈસિસ આકાર લઈ રહી છે. શહેરોમાં ઉધરાવવામાં આવતા મેન્ટેનન્સમાં ૮૦ ટકા રકમ વોટર મેનેજમેન્ટ પાછળ ખર્ચિય છે. ગુજરાતની વાત કરીએ તો કચ્છ, સુરેન્દ્રનગર જેવા અનેક વિસ્તારોમાં ૮૦૦ થી ૧૦૦૦ ફૂટે પણ પાણી મળતું નથી.

છેલ્લા ૨૦ વર્ષમાં દશા ઘણી ખરાબ થઈ છે. પાણીનો વપરાશ ઘૂમ થઈ રહ્યો છે પણ રિચાર્જ માટે કોઈ કામ થતું નથી જેથી ગુજરાતમાં આ વાત ચિંતાજનક છે. રિવર લિંકિગ પ્રોજેક્ટ પણ અસરકારક નહીં નિવડે તેવો મત વ્યક્ત કરતાં કહ્યું કે, સાંભળવામાં આ બંધુય સારું છે પણ વાસ્તવમાં આ પ્રાઇવેટાઇઝેશન ઓફ વોટર સિવાય બીજું કંઈ નથી. આ આખાયે પ્રોજેક્ટ પાછળ યુકે, ફાન્સ સહિત અન્ય સાતેક દેશોની કંપનીઓને ફાયદો થવાનો છે. જો દેશમાં ભૂગર્ભજળ પર લોકોની સામૂહિક ભાગીદારી સાથે કામ નહીં કરાય તો કલાયમેન્ટ ચેન્જની અસર જોવા મળશે. વાદળો ફાટશે અણધાર્યો

પ્રાચીન ભારતીયો પૃથ્વી પર જળનું મહત્વ સારી રીતે જાણતાં - સમજતાં હતા. પ્રાચીન માન્યતાઓ મુજબ, બ્રહ્માંડ પાંચ મૂળભૂત તત્ત્વો કે પંચમહાભૂતનું બનેલું છે. પૃથ્વી, જળ, અઞ્જિ, વાયુ અને આકાશ. ઋગવેદ મુજબ તમામ જીવન જળ સાથે સંકળાયેલા છે. શુદ્ધ પાણી તેની શીતળતા, સ્વચ્છતા, પારદર્શકતા, તટસ્થતા અને ઉપયોગી તત્ત્વોને કારણે દિવ્યજળ કહેવાતું હતું. આ ઉપરાંત જળના તબીબી ગુણધર્મોના પુષ્ટણ સંદર્ભો પણ મળે છે.

પૃથ્વીના બે તૃત્યાંશ ભાગમાં પાણી છે અને માનવીય શરીરનો ૭૫ ટકા હિસ્સો પાણીનો છે. એટલે સ્પષ્ટ છે કે પૃથ્વી પર જીવન માટે પાણી સૌથી મુખ્ય તત્ત્વ છે. આદિકાળથી દુનિયાની મોટાભાગની સંસ્કૃતિઓ નદી ડિનારે જ પાંગરી છે. આપણા પૂર્વજોએ ખેતીવાડી કરવા જળની ઉપલબ્ધતા વિસ્તારોની આસપાસ નાના શહેરોની રચના કરી હતી, કારણ કે મનુષ્ય જીવનનો આધાર પાણી છે.

અત્યારે આ કિંમતી સંસાધન આપણા અર્થતંત્ર માટે અતિ મહત્વપૂર્ણ પરિબળ બની ગયું છે. તે ફક્ત ખેતીવાડી, ઉદ્યોગ પરિવહન માટે જ આવશ્યક ઘટક નથી, પણ વન્યજીવન, મનોરંજન અને પર્યાવરણ માટે પણ આધારભૂત પરિબળ છે. જો કે અગાઉથી વિપરીત આધુનિક

૪૩

ગ્રામસ્વરાજ

સમાજ જીવનના આ ચમત્કારિક ઘટક પ્રત્યે છે. ઉદાસીનતા સેવે છે. નદીઓ, સમુદ્રો અને મહાસાગરોનો અયોગ્ય રીતે ઉપયોગ થઈ રહ્યો છે અને તેને મોટા પાયે પ્રદૂષિત કરવામાં આવે છે, જેના પગલે દુનિયાના લગભગ મોટા ભાગના વિસ્તારોમાં પાણી દુર્લભ ચીજવસ્તુ બની ગઈ છે. ગામડાઓમાં ધરગથ્યુ ઉપયોગ

માટે પાણીની શોધમાં કિંમતી માનવીય દિવસોનું નુકસાન થઈ રહ્યું છે. શહેરી વિસ્તારોમાં પણ પાણીને લઈને અવારનવાર લડાઈ થાય છે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પાણીની તીવ્ર ખેંચ જોવા મળે છે, જેના પગલે કૃષિને મોટા પાયે નુકસાન થાય છે અને કૃષિના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. પાક નિષ્ફળ જવાથી નિરાશ બેદૂતો આત્મહત્યા કરી રહ્યાં છે. બીજ તરફ, દર વર્ષ કોઈને કોઈ ભાગમાં પુર આવવાથી જાનમાલની મોટા પાયે હાનિ થઈ રહી છે. આ વિરોધાભાસ આપણા અર્થતંત્રનું કાયમી પાસું બની ગયો છે.

આ સ્થિતિની ગંભીરતા સમજીને દુનિયાભરના નિષ્ણાતો જળનું સરકાણ કરવા નવા માર્ગો શોધી રહ્યાં છે. સરકારો પાણી સંબંધિત સમસ્યાઓનું સમાધાન કરવા માટે નીતિનિર્દેશો ઘડવામાં વ્યસ્ત છે. ભારત સરકારે બેદૂતો અને સામાન્ય નાગરિક એમ બંને માટે પૂર અને દુષ્કાળગ્રસ્ત લોકોની સમસ્યા હળવી કરવા વિવિધ પગલાં લીધો છે. સિંચાઈની આધુનિક પદ્ધતિઓ વિશે બેદૂતોને જાગૃત કરવા

માટે અભિયાન ચલાવવામાં આવે છે. પ્રધાનમંત્રી સિંચાઈ યોજના આ પ્રકારનો એક કાર્યક્રમ છે. વરસાદના પાણીનું સંરક્ષણ અને પૂરના પાણીનું વ્યવસ્થાપન જેવી જળ સંરક્ષણ પદ્ધતિઓ સમગ્ર દેશમાં મોટા પાયે પ્રસ્તુત કરવામાં આવી છે, જેથી જળ કટોકટીનું નિવારણ થઈ શકે.

જ્યારે નદીનું ખેડાણ મોટા પાયે કેટલીક નદીઓના વધારાના પાણીથી અન્ય વિસ્તારોના નદીઓના સૂક્ષ્મ પટને ભરશે તેવી અપેક્ષા છે, ત્યારે મોટી નદીઓ પરના એમ પૂર દરમિયાન વધારાના પાણીનો સંગ્રહ, સિંચાઈ, વીજ ઉત્પાદન અને વિવિધ હેતુઓ માટે કરી શકશે. નમામી ગંગે અને યમુના એકશન પ્લાન જેવા પ્રોજેક્ટ સૂક્ષ્મ અને મૃત્યુપાય નદીઓને નવજીવન આપશે તેવી સંભાવના છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ પ્રત્યે પ્રતિબદ્ધતા દાખવવાની અને યુદ્ધના ધોરણે કામ કરવાની જરૂર છે.

ગુજરાતીમાં કહેવાય છે કે જળ એ જ જીવન છે એટલે કે જો જળ છે તો જ આપણનું ભવિષ્ય સલામત છે. જોકે આપણે કુદરતની આ કિંમતી ભેટનો વિચાર કર્યા વિના ઉપયોગ કરી રહ્યાં છીએ. અત્યારે દરેક જળચક અને જીવનચક એક જ એ બાબત સમજે તેનો ઉચિત સમય છે. એટલે અત્યારથી ચાલો આપણે પાણીની એક એક બુંદ બચાવવાની શરૂઆત કરીએ.

ગીગાસણ : જળસંચયમાં આત્મનિર્ભર બનેલું ગામ

અમરેલી જિલ્લાના ધારી તાલુકા મથકથી દસેક કિલોમીટરના અંતરે ગીગાસણ નામનું ગામ ગુજરાતનાં અન્ય ગામો જેવું જ છે. જોકે, એક વાત છે કે જે ગીગાસણ ગામને અન્ય તમામ ગામડાઓ કરતા નોંધું પાડે છે અને તે આત્મનિર્ભર જળસંચય. કોઈ પણ પ્રકારની સરકારી મદદ વગર ગામલોકોએ બેગા મળીને લગભગ ૬૦ જેટલા ચેકડેમ બનાવી જળસંચયની ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. તે ખરેખર આદર્શરૂપ છે.

પાણીની અછત ભોગવતું ગામ

૨૫૦૦ લોકોની વસ્તી ધરાવતા ગીગાસણ ગામનો મોટો વર્ગ વ્યવસાય માટે અમદાવાદ, સુરત, અંકલેશ્વર, નવસારી જેવાં શહેરોમાં સ્થાયી થયો છે. ગામમાં રહેતા લોકો મુખ્યત્વે ખેતી સાથે સંકળાયેલા છે. જે રીતે ભૂગર્ભ જળનાં સ્તર ઊંડાં જઈ રહ્યાં છે. તેમાંથી ગીગાસણ ગામ પણ બાકાત નહોતું.

રેકોર્ડબેક શિયાળું પાક

ગીગાસણ ગામને અહીને જ અમરેલી જિલ્લાની સૌથી મોટી નદી શેન્નુંજ પસાર થાય છે. ગામના પાદરમાંથી પણ એક નદી પસાર થાય છે, પરંતુ આ નદીમાં પણ ચોમાસા પૂરતું

પાણી રહે છે. જો વધારે સારો વરસાદ હોય તો વળી થોડું લાંબું ટકે. જેવી નદીઓ બંધ થાય કે ખેતરોના બોર અને ફૂવામાં પાણી ઓસરવા માંડે. જેના કારણે ખેડૂતો શિયાળું પાક પણ બરાબર લઈ શકતા નહોતા. જોકે, હવે ચિત્ર બદલાયું છે. છેલ્લા ત્રણેક વર્ષથી ગામમાં રેકોર્ડબેક શિયાળું પાકનું વાવેતર થઈ રહ્યું છે. ભૂગર્ભ જળનાં ઊંડાં ઊતરી ગયેલાં સ્તર ફરી પાછા ઉપર આવવાની શરૂઆત થઈ છે. જેનો સીધો ફાયદો ખેડૂતો અને ખેતીને થયો છે.

એક ગામ, સાઠ ડેમ

આ બદલાવનું નામ છે ચેકડેમ. ગામની આસપાસથી પસાર થતાં નદી-નાળાં પર લગભગ ૬૦ જેટલા ચેકડેમ બાંધીને જળસંચયની કામગીરી કરવામાં આવી છે. તેના લીધે વહી જતા પાણીનો સંગ્રહ થયો અને તે જમીનમાં ઊતરવા લાગ્યું છે. ખાસ વાત તો એ છે કે આ ચેકડેમ સરકારે નથી બનાવ્યા કે પછી સરકારી સહાયથી પણ નથી બન્યા. ગીગાસણ ગામના લોકો આત્મનિર્ભર બન્યા છે.

અમદાવાદમાં વસતા ગીગાસણ ગામના લોકોએ ગામને મદદરૂપ થવા અને માતૃભૂમિનું

૪૦ ગ્રામસ્વરાજ

જીણ ચૂકવવાના ઉદેશથી ૨૦૦૪માં શ્રી જોડાયેલા લોકોએ સસ્તા ભાવે સિમેન્ટ-લોખંડ ગીગાસણ કેળવણી મંડળ - અમદાવાદ'ની જેવું રો મટિરિયલ મોકલાવ્યું. ચેકડેમના સ્થાપના કરી. સંસ્થાના સ્થાપક હતા ડૉ. બાંધકામ માટે જરૂરી સાધનો પણ ગામડે મનસુખભાઈ કોટડિયા. ગામમાં મોટી સંખ્યામાં પહોંચાડવામાં આવ્યાં. પછીનું કામ ચેકડેમ બનાવવાનો વિચાર પણ આ સંસ્થાના ગામવાસીઓએ સંભાળી લીધું.

હોદેદારોને જ આવ્યો હતો. તે સમયે ભરતભાઈ ભુવા સંસ્થાના પ્રમુખ હતા. ગામલોકોને આર્થિક પગબર બનાવવા માટે ખેતીને સદ્ગ્ર કરવી પડે અને ખેતીને સદ્ગ્ર કરવા માટે પાણીની સમસ્યાનું નિવારણ કરવું પડે. ત્યારબાદ ગામમાં ચેકડેમ બનાવવાનો પ્રોજેક્ટ અમલમાં મૂકાયો.

જેવી શક્તિ, એવી ભક્તિ શ્રી ગીગાસણ કેળવણી મંડળ - અમદાવાદ પાસે જે ભંડોળ હતું. તે મર્યાદિત હતું તેમાંથી અમુક ચેકડેમ જ બને તેમ હતા. જેથી દાતાઓ આગળ આવ્યા અને આત્મનિર્ભરતાના આ અભિયાનમાં પોતાનું યોગદાન આપ્યું.

અમદાવાદથી લઈને અમેરિકા સુધી ગામલોકો પહોંચ્યા છે. તેમાં કોઈ ડોક્ટર છે, કોઈ બિલ્ડર છે, કોઈ અધિકારી છે તો કોઈ અન્ય નાના મોટા ધંધા અને નોકરી સાથે સંકળાયેલા છે. આત્મામ લોકોએ પાંચ લાખથી માંડી પાંચ હજાર સુધીનું દાન આપ્યું. ગામમાં રહેતા લોકોએ પણ તેમની શક્તિ પ્રમાણે આ કામમાં આર્થિક અને શ્રમિક સહયોગ આપ્યો.

ભંડોળ મળી ગયા પછી શું? ભંડોળ તો એકહું થઈ ગયું. હવે વારો હતો કામ શરૂ કરવાનો. અમદાવાદમાં બાંધકામ સાથે

ગીગાસણ ગામના જળસંચયના આ કામ પાછળ અત્યાર સુધીમાં એક કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. એક કરોડના ખર્ચમાં લગભગ ૬૦ જેટલા ચેકડેમ બનાવવામાં આવ્યા છે. તો કેટલાક જૂના ચેકડેમનું રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે. ગામની સીમમાં જ્યાંથી પણ નાનાંમોટાં નદી-નાળાં પસાર થતા હોય અને ચેકડેમ બને તેવી જગ્યા હોય ત્યાં નાના મોટા ચેકડેમનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ડેમ બની ગયા પછી જળવણી

આ સિવાય હવે ચેકડેમની અંદર જમા થયેલી માટીને ઉકેરવાનું કામ કરવામાં આવશે. ચેકડેમમાં ધોવાણ થઈને આવેલી માટીને લોકોના જેતરોમાં નખાશે. તેથી ચેકડેમની જળ સંગ્રહ શક્તિ વધશે અને સામે જેતરોની જમીન પણ ફળદૂપ બનશે.

અન્ય ગામો પ્રેરણા લેશે?

ઘણાંબધાં ગામડાંઓમાં ગામલોકો ભેગા મળીને કોઈ ને કોઈ કાર્યો કરતા હોય છે. ગામના પ્રવેશદ્વાર બનાવે, મંદિર બનાવે. ડાયરાઓના આયોજન થાય કે પછી સમાજની

(અનુ. પાના નં. ૫ પર)

ડિજિટલ યુગમાં વધતા સાઈબર ગુનાથી સાવધાન રહો

ભારત હવે ડિજિટલ ઈન્ડિયા બની રહ્યું છે. ભારત ભલે કોમ્પ્યુટર અને ટેકનોલોજીનાં ઉપયોગમાં બે-ત્રણ દાયકા પાછળ રહ્યું હતું. પરંતુ, હવે ડિજિટલ દુનિયામાં ભારતે મોટો કૂદકો માર્યો છે. ઓનલાઈન વેપાર, ઈ-કોમર્સ, ઓનલાઈન શિક્ષણ, ઈ-ગવર્નન્સ અને ખાસ કરી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં ભારત ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. ૨૦૧૫માં નોટબંધીની સૌથી મોટી અસર ડિજિટલ કાંતિ છે. નોટબંધી પછી ધંધા, વેપાર, વ્યવસાય અને સેવાના ટૂલ્સ-સાધનો બદલાયા, સ્વરૂપ બદલાયા અને રીત પણ બદલાઈ ગઈ છે. છેલ્લા એક દાયકામાં ભારતનું અર્થતંત્ર મજબૂત બની રહ્યું છે. તેની સાથે અર્થતંત્રના સપોર્ટમાં ડિજિટલ સિસ્ટમે ખૂબ મોટો ભાગ ભજવ્યો છે. ભારતનું બેન્કિંગ ક્ષેત્ર અન્ય દેશો કરતા મજબૂત છે અને મહત્તમ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. વર્તમાન ડિજિટલ યુગની સૌથી મોટી પડકારજનક આડપેદાશ સાઈબર ગુનાઓ અને ફોડ વધી રહ્યા તે છે. આજના ડિજિટલ યુગમાં દરેક લોકો સોશિયલ મીડિયાથી

કાન્ક ભાલાળા
વાઈસ ચેરમેન,
સાઉથ ગુજરાત અર્બન કો-ઓપરેટિવ
બેન્ક એસોસિએશન, સુરત

જોડાયેલા છે. સાઈબર ગઠિયાઓ આવા પ્લેટફોર્મનો ઉપયોગ કરી આર્થિક છેતરપિંડી અને અનેક પ્રકારના ગુનાઓનો અંજામ આપી રહ્યા છે. વધતા સાઈબર કાઈમને નાથવા માટે સાઈબર કાયદો-ધી ઈન્ફોર્મેશન ટેકનોલોજી એકટ ૨૦૦૦ અમલમાં આવ્યો છે. ઈન્ટરનેટનો ઉપયોગ કરી લોકો સાથે છેતરપિંડી કે લોકોને ફસાવી ધમકાવી કોઈપણ પ્રકારના ગુનાઓ કરતા ગુનેગારો સામે ભોગ બનતા લોકોને કાનૂન રક્ષણ પૂરું પાડે છે અને પોલીસંતત્ર તરફથી જાગૃતિ માટે પ્રયાસ પણ થઈ રહ્યા છે. પરંતુ, દરરોજ અસંખ્ય સાઈબર કાઈમફોડ બની રહ્યા છે. આ ડિજિટલ યુગમાં વધી રહેલા સાઈબર ગુનાઓથી સાવચેત, જાગૃત અને સાવધાન રહેતે શ્રેષ્ઠ ઉપાય છે. તાજેતરમાં ડિજિટલ એરેસ્ટ નવો શર્જ સાંભળવા મળ્યો છે. સુરતમાં એક મહિલા તબીબને મની લોન્ડરિંગ કેસના નામે ધમકાવી ડિજિટલ એરેસ્ટ કરી પૈસા પડાવવાના સમાચાર સામે આવ્યા છે. નકલી મુંબઈ પોલીસ અને નકલી સી.બી.આઈના નામે મહિલાને ફોન કરી તમારી સામે બેંક ખાતાઓમાં થયેલા વ્યવહારો માટે મની લોન્ડરિંગનો કેસ થયો છે. તેમને વીડિયો કોલ કરી સી.બી.આઈનો લોગો દેખાડી એફ.આઈ.આર નંબર મોકલી ડિજિટલ એરેસ્ટ

૪૩

ગ્રામસ્વરાજ

જેવી પરિસ્થિતિ ઊભી કરી પૈસા પડાવવાની ચોંકાવનારી ઘટના બની છે. આખરે સુરતમાં આ છેતરપિંડીની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. ફોન કરી પૈસાની મદદ માગવી કે સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી મદદ માંગવી કે પાસવર્ડ ઓટીપી માંગી ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરી લેવાની ઘટનાઓ સામાન્ય બની રહી છે. રોજ વર્તમાન પત્રોમાં સાઈબર છેતરપિંડી કે નિતનવા ગુનાઓ બની રહ્યા છે.

વિદેશના વિઝા લેવા માટે દુલ્ખિકેટ માર્કશીટ અને (સર્ટિફિકેને બનાવી લાખો રૂપિયા પડાવી લેવાનું આંતરરાજ્ય કૌભાંડ ખૂલ્યું છે. આ સાઈબર કાઈમ છે. વિદેશ જવાની લાલચમાં લોકો છેતરાઈ રહ્યા છે. માણસ સોશિયલ મીડિયાની માયાજળમાં ફસાયેલો છે તેનો ફાયદો ડિજિટલ ગઠિયા ઉઠાવી રહ્યા છે. ખોટા ફોન કરી લોકોને જાળમાં ફસાવવા માટે મોટી સંઘામાં ટોળકીઓ સક્રિય છે. ધંધો-વ્યવસાય હોય કે પછી સામાન્યજીવન, ટેકનોલોજી અને સોશિયલ મીડિયાથી જોડાયેલા છીએ. એટલે જો સાવધાની રાખવામાં નહીં આવે તો છેતરપિંડી કે કોઈ મોટા ગુનાઓનો ભોગ બની જવાય તેવી સ્ફોર્ટક પરિસ્થિતિનું નિર્મણ થયું છે. છેતરીને કે પછી ધમકાવી અથવા તો બ્લેકમેલ કરીને પૈસા ટ્રાન્સફર કરાવી લેવામાં આવે છે. સાઈબર ગુનાઓને કોઈ સીમાડા નડતા નથી પરિણામે, પોલીસની પહોંચથી દૂર રહે છે. જો વ્યક્તિ ખુદ જાગૃત નહીં રહેતો સાઈબર ફોડના પૈસા પરત મેળવવા મુશ્કેલ છે. પરંતુ, જો ડિજિટલ ફોડનો ભોગ

બનનાર ખુદ જરૂરથી ૧૯૩૦ નંબર ઉપર જાણ કરે તો તેવા સંજોગોમાં ગયેલા પૈસા પરત મળી શકે છે. કોઈપણ શુનામાં ફસાયા પદ્ધી પણ જરૂરથી પોલીસ ફરિયાદ કરવી તે હિતાવહ છે. હવે બાળકો હોય કે મોટા હોય કે પછી મહિલા હોય દરેક ઉમરના લોકો સાઈબર કાઈમનો ભોગ બની રહ્યા છે. શિક્ષિત કે અભિજા, ગામદું હોય કે શહેર હોય લોકો સાથે સાઈબર કાઈમ બની રહ્યા છે.

વર્તમાન સમયે હનીટ્રેપ કે ન્યૂડ વીડિયો કોલ કરી લોકોને ફસાવનારી અનેક ગેંગ સક્રિય છે. ફસાયેલા લોકો ચૂપચાપ પૈસા આપી દે છે. અતિશય થાય અથવા હિમત કરી પોલીસ ફરિયાદ કરે ત્યારે જ વિગત બહાર આવે છે. તાજેતરમાં સુરતમાં હનીટ્રેપ કરતી એક કરતા વધુ ટોળકીનો પર્દફિશ થયો છે. નોકરી આપવાની લાલચ કે આર્થિક અન્ય લાભની લાલચ આપી લોકોને ઓનલાઈન જોડે છે. થોડા દિવસ પહેલા ગાંધીનગરના નિવૃત્ત ઉચ્ચ અધિકારીએ શોટ ટ્રેડિંગના નામે ૨૧ લાખ ગુમાવ્યા છે. ફોનમાં આવતી એપ્લિકેશન ડાઉનલોડ કરી ચૂપમાં જોડી છેતરપિંડી કરવામાં આવે છે.

મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ કે ઇન્ટરનેટના માધ્યમથી કોઈપણ પ્રકારની લાલચ, છેતરપિંડી, ધાક-ધમકી, નાણાકીય ફોડ, અપમાનજનક ભાષાનો ઉપયોગ પાસવર્ડ કે ઓટીપી ડેટા ચોરી જેવા ગુનાઓને સાઈબર કાઈમ કહેવાય છે. અને ડિજિટલ નાણાકીય છેતરપિંડીને સાઈબર ફોડ કહેવામાં આવે છે.

ગ્રામસ્વરાજ

જે સાઈબર કાઈમનો જ એક પ્રકાર છે. સાઈબર કાયદાથી સાઈબર કાઈમ સામે લોકોને રક્ષણ મળે છે. પરંતુ, ભોગ બન્યા પછી પોલીસ ફરિયાદ કરવાની હિંમત અને જાગૃતિ રાખવી જોઈએ. તેના કરતાં સાઈબર કાઈમનો આપણે ભોગ જ ન બનીએ તેટલી સાવધાની રાખવી ખૂબ જરૂરી છે.

ધણીવાર માણસની ભૂલ હોય પરંતુ, ટેક્નિકલ ભૂલ ટેક્નિકલ સિસ્ટમથી ગુનાઓ થતા હોય છે. ડેક્િંગ, ટેટા ચોરી, સાઈબર બુલિંગ, સોશિયલ મીડિયા ફોડ, નાણાકીય ફોડ અથવા તો માલવેર કે રેન્સમવેર વાઈરસથી કોમ્યૂટરમાંથી ટેટા ચોરી અને પછી નાણાં છેતરપિંડી થતી હોય છે. ઇન્ટરનેટ લોન એપથી ઘણા લોકો છેતરપિંડીનો ભોગ બને છે. બનાવટી લિંક કે ફેક કોલ ટેટાથેફિટ અને કસ્ટમર કેરમાં ફેક નંબર મૂકી લોકો સાથે સરળતાથી આર્થિક છેતરપિંડી થાય છે. SIM સ્લેપ કે SIM કલોનિંગ ફોડ પણ વધી રહ્યા છે. સાઈબર ગઠિયા મોબાઇલ નેટવર્કના કર્મચારી બની 4Gમાંથી 5Gમાં કન્વર્ટ કરવાના બહાને માહિતી મેળવી લે છે અને છેતરપિંડી આચરે છે. કોઈપણ વ્યક્તિ સોશિયલ મીડિયાના માધ્યમથી છોકરા કે છોકરીને માનસિક પરેશાન કરે જાતીય શોષણ ધમકી આપવી કે છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવો એ સાઈબર બુલિંગ કહેવાય છે. જે સાઈબર કાઈમ છે.

ચાઈલ્ડ પોનોગ્રાફી સૌથી મોટું દૂષણ છે. બાળકોના અશલીલ વીડિયો, ફોટોગ્રાફ સંબંધિત

માટિરિયલ બનાવવું રાખવું ડાઉનલોડ, અપલોડ અને શેર કરવું તે ગંભીર અપરાધ છે. જેમાં પાંચ વર્ષ સુધી કેદ અથવા રૂપિયા ૧૦ લાખ સુધીના દંડની જોગવાઈ છે. સાઈબર કાઈમથી બચવા માટે લોકોએ જાગૃતિ દાખવવાની જરૂર છે. પિન નંબર કે ઓટીપીની માહિતી અજાણ્યાને ન આપવી. સોશિયલ મીડિયામાં કોલ, અજાણી વ્યક્તિનો વીડિયો કોલ અને રિક્વેસ્ટ સ્વીકારો નહીં. કોઈ કાઈકે બેંક ખાતાની વિગત અજાણ્યા વ્યક્તિને ન આપો. મોબાઇલ કોમ્યૂટરના પાસવર્ડને સુરક્ષિત રાખો અને સમયાંતરે તે બદલતા રહો. ઝી લોન, ઝી ઇન્ટરનેટ કે મફતમાં મળનાર કોઈ લાભ માટે અજાણી લિંક ક્લિક કરશો નહીં. મોટે ભાગે કોઈને કોઈ રીતે પૈસાની માગણી કરે તો અજાણી વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરવા નહીં.

વર્તમાન ડિજિટલ યુગમાં ડિજિટલ માર્કેટિંગ વધી રહ્યું છે. ડિજિટલ કરન્સી પણ આવી રહી છે. ડિજિટલ નાણાકીય વ્યવહાર કર્યું વગર છૂટકો જ નથી તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પરંતુ, સામાન્ય માણસ સતત ડિજિટલ ફોડ થવાના ઉરથી પીડાઈ રહ્યો છે. સાઈબર ફોડનો ભોગ ન બનવું હોય તો ટેકનોલોજીના જાણકાર બનો અને સાવધાન રહો. પરંતુ, તેમ છતાં સાઈબર કાઈમનો ભોગ બન્યા તો તુરંત પોલીસને જાણ કરવી જોઈએ નવા યુગની આ છેતરપિંડી સામે લોકોએ વધુમાં વધુ જાગૃત થવાની જરૂર છે.

યોગદર્શન

૨૧મી જૂન આંતરરાષ્ટ્રીય યોગદિન યોગમય બનીએ માનવતાની મહેક પ્રસરાવીએ

બે નરેન્દ્રએ વૈશ્વિક્સર્તરે ભારતવર્ષના પ્રાચીન વારસાની પહેચાન કરાવી છે. પહેલાં નરેન્દ્ર છે – સ્વામી વિવેકાનંદ અને બીજા છે ભારત દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી. ૧૧મી સપ્ટેમ્બર ૧૮૮૩માં અમેરિકાના શિકાગો શહેરમાં વિશ્વર્ધમ સંમેલનમાં સૌ પ્રથમવાર નરેન્દ્ર-સ્વામી વિવેકાનંદજીએ ભારતવર્ષના ધાર્મિક, આધ્યાત્મિક, કર્મયોગની સમજ આપી હતી. તે પછી ૧૨૧મા વર્ષે ૨૭મી સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આપણા દેશના પ્રાચીન અમૂલ્ય વારસા સમાન ‘યોગ’ની પહેચાન સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભામાં કરાવી. ભારતવર્ષ વિશ્વને યોગની ઓળખ આપી અને વિશ્વસ્તરે યોગ દિવસ ઉજવણીનો શુભારંભ થયો.

સને ૨૦૧૪માં ભારતદેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભામાં સૌપ્રથમવાર યોગના વિચારને મૂક્યો અને એ વિચાર પ્રસ્તાવનો સહર્ષ સ્વીકાર થયો. તારીખ

કિરણ ચાંપાનેરી (યોગ સાધક)

૧૦૪/૧૮૪૨, કૃષ્ણનગર,
સેજપુર, અમદાવાદ-૪૮
મો.૮૬૬૨૮૮૫૨૬૮

૧૦-૦૬-૨૦૨૪

૨૭મી સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘ મહાસભાના ૪૮માં મહિમા વર્ષાવી વિશ્વ સમુદાયને યોગનો મહિમા વર્ષાવી વિશ્વ સમુદાયને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવા આહવાન કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીએ જણાવ્યું હતું કે, “યોગ પ્રાચીન ભારતીય પરંપરા તથા સંસ્કૃતિની અણામોલ ભેટ છે. યોગ અભ્યાસ શરીર અને મન, વિચાર અને કર્મ, આત્મસંયમ અને પૂર્ણતાની એકાત્મકતા અને માનવ તથા પ્રકૃતિ વચ્ચે સામંજસ્ય સ્થાપે છે. યોગ સ્વાસ્થ્ય અને કલ્યાણનો પૂર્ણતાવાદી દિષ્ટિકોણ છે. યોગ માત્ર વ્યાયામ નથી, પરંતુ પોતાની જાત સાથે, વિશ્વ અને પ્રકૃતિની સાથે એકત્વ સાધવાનો માર્ગ છે. યોગ આપણી જીવનશૈલીમાં પરિવર્તન લાવીને આપણામાં જાગૃતતા પેદા કરે છે. પ્રાકૃતિક પરિવર્તનોથી શરીરમાં થનાર બદલાવોને સહન કરવામાં સહાયક બની શકે છે... આવો આપણે બધાં સાથે મળીને યોગને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રૂપે સ્વીકાર કરવાની દિશામાં કાર્ય કરીએ...”

આ મનનીય ભાષણ પછી ૧૧મી ડિસેમ્બર-૨૦૧૪ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘ મહાસભાના ૧૮૩ સભ્ય દેશોમાંથી ૧૭૭ દેશોના સમર્થન સાથે ‘૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગદિન’ તરીકે ઉજવવાનો સંકલ્પ સર્વસંમતિ સાથે પસાર કરવામાં આવ્યો. ઉત્તરીય ગોળાઈંમાં ૨૧મી જૂનનો દિવસ

૩૨

ગ્રામસ્વરાજ

સૌથી લાંબો દિવસ હોય છે. આ કારણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોટીએ ૨૧મી જૂને વિશ્વ યોગ દિવસ ઉજવવાનું સૂચન કરેલું. પછીના વર્ષે સને ૨૦૧૫માં ૨૧મી જૂને સમગ્ર વિશ્વમાં ‘સંવાદિતા અને શાંતિ માટે યોગ’ થીમ આધારે પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો. ત્યાર પછીના વર્ષોમાં જુદી જુદી થીમ આધારે વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ. સને ૨૦૧૬માં ‘ટકાઉ વિકાસ લક્ષ્યોની સિદ્ધિ માટે યોગ’, સને ૨૦૧૭માં ‘સ્વાસ્થ્ય માટે યોગ’, સને ૨૦૧૮માં ‘શાંતિ માટે યોગ’, સને ૨૦૧૯માં ‘હૃદય માટે યોગ’, સને ૨૦૨૦માં કોવિડ-૧૯ની મહામારીમાં ‘ધરે યોગ અને પરિવાર સાથે યોગ’ અને સને ૨૦૨૧માં ‘સુખાકારી માટે યોગ’ થીમ આધારે ઓનલાઈન ઉજવણી કરવામાં આવી હતી.

સને ૨૦૨૨માં ‘માનવતા માટે યોગ’ અને ૨૦૨૩માં ‘વસુધૈવ કુટુંબકમ્ માટે યોગ’ થીમ આધારે યોગ દિવસ ઉજવાયા હતા. આ વર્ષે ૨૦૨૪ની થીમ છે ‘માનવતા’.

આપણા દેશમાં યોગ પ્રત્યે પ્રજામાં જગૃતિ લાવવા ભારત સરકારના આયુષ્ય મંત્રાલય દ્વારા આગવા પ્રયાસો થઈ રહ્યા છે. વિવિધ રાજ્યોમાં યોગને લોકલોગ્ય અને યોગના વિચાર પ્રચાર પ્રસાર તથા આમાર્ગ્ઝ સુધી પહોંચાડવા માટે યોગ પરિષદ કે યોગ બોર્ડની રચના કરવામાં આવેલ છે. હરિયાણામાં હરિયાણા યોગ પરિષદ અને ૨૧મી જૂન-૨૦૧૯થી ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના થઈ છે. આ પરિષદ અને યોગ બોર્ડ ગામ, નગર, શહેરોમાં યોગ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપીને યુવાનોને યોગ ઓભેચિયાડ માટે તૈયાર કરે છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ, યોગ ટ્રેઇનરો ગામ-નગર-શહેરોમાં સવાર-સાંજ નિઃશુલ્ક યોગ વર્ગનું સંચાલન કરે છે. જે સાધકોને યોગમાં રસ છે તેઓ આવા યોગ વર્ગમાં સામેલ થઈ યોગાભ્યાસ કરે છે અને પોતાના જીવનને યોગમય બનાવી આનંદમય બનાવે છે.

૨૧મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવન ઉજવણીની ઘોષણા અને યોગ દિવન ઉજવણીના પરિણામે યોગ પ્રત્યે લોકોમાં જગૃતિ વધતી જાય છે. યોગ-‘યોગા’ અંગે વર્તમાન સમયે સમાજમાં ઘણી ગેરસમજ અને ભામક માન્યતા પ્રવર્તે છે. આવો આપણો યોગ અંગેની સાચી સમજ કેળવીએ અને ખરેખર ‘યોગ’ શું છે તે જાણીએ...

આજે યોગ ખૂબ લોકપ્રિય બનતો જાય છે. ‘યોગ’ આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ તરફથી મનુષ્ય જાતિને મળેલી સૌથી અમૂલ્ય ભેટ છે. ‘યોગ’ - યોગવિદ્યા ખરેખર શું છે? તેનો સાચો ઘ્યાલ લોકોને નથી. આજે તો લોકમાનસમાં યોગવિદ્યા નહીં પણ ‘યોગા’ ઘૂમે છે. યોગ એટલે આસન કરીને શરીરને તંદુરસ્ત રાખવું-બનાવવું, સૌંદર્ય વધારવું, શરીરનું વજન ઘટાડવું-વધારવું, શરીરને સુદૃઢ બનાવવું એવું માનવામાં આવે છે. વાસ્તવમાં યોગદર્શન, યોગવિદ્યા તો આત્માની ઓળખ અને પરમાત્માની પહેંચાન કરાવતું દર્શનશાસ્ત્ર છે. યોગદર્શન જીવ, જગત અને ઈશ્વરના સ્વરૂપને સમજાવે છે.

યોગ એ કોઈ ધર્મ નથી. યોગ તો માનવધર્મ છે. યોગ તો જીવનધર્મ છે. યોગ તો જીવન જીવવાની સાચી કણા છે. દુનિયામાં બધા પ્રાચીન ધર્મોમાં યોગ કયાંક વણાયેલ છે.

ગ્રામસ્વરાજ

યોગાભ્યાસથી વ્યક્તિત્વનો સંપૂર્ણ વિકાસ થાય છે. વ્યક્તિના વ્યક્તિત્વનો વિકાસ થતાં ધીમે ધીમે આત્મસાક્ષાત્કાર તરફ યાત્રા આગળ વધે છે.

યોગવિદ્યા, યોગદર્શન વ્યક્તિના આત્મવિકાસનું વિજ્ઞાન છે. યોગવિદ્યા વ્યક્તિને પરમ સત્ય સુધી લઈ જાય છે. યોગવિજ્ઞાન એ પરમસત્યની પ્રાપ્તિ માટેનો માર્ગ બતાવે છે. યોગવિદ્યાને સૈદ્ધાંતિક રીતે જાગ્રવાથી કંઈ લાભ થતો નથી. યોગનો ખરો લાભ તો તેના પ્રાયોગિક અભ્યાસ કરવાથી ચોક્કસ પરિણામ મળે છે. યોગાભ્યાસથી આંતરિક આત્મિક સૌંદર્ય વધે છે. વ્યક્તિત્વમાં આમૂલ પરિવર્તન આવે છે. યોગાભ્યાસથી વ્યક્તિના વર્તન, બ્યવહાર અને વાણીમાં બદલાવ આવે છે.

યોગવિદ્યા, યોગદર્શન, યોગવિજ્ઞાન આત્મસાક્ષાત્કારથી પરમ સાક્ષાત્કારનું વિજ્ઞાન છે. યોગદર્શન જીવ, જગત અને ઈશ્વરના સ્વરૂપને સમજાવતું દર્શનશાક્ત છે. યોગદર્શનનો ઉદ્ભબ ચિકિત્સા માટે થયો નહોતો. તેમ છતાં નિયમિત ચોક્કસ પ્રમાણેનો યોગાભ્યાસ દેહધાર્મિક કિયા સંબંધી અથવા મનોશારીરિક વ્યાધિની સારવારમાં અસરકારક પુરવાર થયેલ છે. નિયમિત યોગાભ્યાસથી વ્યક્તિત્વના મનોમયકોશ પર નિયંત્રણ મેળવી શકાય છે. મનોમય કોશ પર નિયંત્રણ મેળવી બધા જ પ્રકારની વ્યાધિ પર નિયમન પ્રામ કરી શકાય છે.

આમ, યોગ તો સુવ્યવસ્થિત વિજ્ઞાન છે. યોગ કોઈ ચમત્કાર નથી. વળી યોગાભ્યાસ માટે ઘરસંસાર છોડી જંગલમાં જવાની કે ભગવા ધારણ કરવાની જરૂર નથી. ગૃહસ્� જીવન જીવતાં જીવતાં

પોતાના કર્તવ્ય નિભાવતા સમતાભાવમાં રહીને યોગાભ્યાસ થઈ શકે છે. યોગાભ્યાસથી વ્યક્તિના આંતરિક વ્યક્તિત્વમાં હકારાત્મક પરિવર્તન આવે છે. વ્યક્તિની નકારાત્મક વિચારધારા બદલાઈને સકારાત્મક બને છે. વ્યક્તિ સ્વકેન્દ્રી મટીને સમગ્ર સમિષણી બની જાય છે.

આજે સામાન્ય રીતે બગીચાના અને યોગ સ્થુદિયોમાં ચાલતા યોગવર્ગમાં શારીરિક કસરત રૂપે યોગાભ્યાસ કરાવાય છે. વાસ્તવમાં યોગ એ શારીરિક કસરત નથી. યોગદર્શન તો આત્મા-પરમાત્માના મિલનનું માધ્યમ છે. મહર્ષિ પતંજલિના અષ્ટાંગયોગમાંથી આસન અને પ્રાણાયામનો અભ્યાસ શારીરિક પ્રક્રિયા સાથે સંકળાયેલ છે. જ્યારે અન્ય પગથિયા માનસિક અભ્યાસ છે.

યોગવિદ્યા પરમસત્યને પામવાનો માર્ગ છે. પરમ સત્યની ઓળખ મનુષ્ય વ્યક્તિત્વ વિકાસ દ્વારા જ પ્રામ કરી શકાય છે. યોગાભ્યાસ વ્યક્તિત્વને પૂર્ણતા તરફ લઈ જાય છે.

યોગદર્શનના પ્રણેતા મહર્ષિ પતંજલિએ યોગસૂત્ર આપ્યું. યોગસૂત્રમાં યોગનું વિગતવાર, કમબદ્ધ, પદ્ધતિસરનું નિરૂપણ છે. યોગમાર્ગને અનુસરે તે યોગી. યોગની સાધના કરે તે યોગસાધક છે. પ્રાચીન ભારતીય ધર્મશાસ્ત્રોમાં યોગવિદ્યાની વિસ્તૃતરૂપે ચર્ચા કરવામાં આવી છે. વેદ, ઉપનિષદ, મહાભારત, શ્રીમદ્ભગવદ્ગીતા વગેરે ધર્મગ્રંથોમાં યોગવિદ્યાનું નિરૂપણ છે. યોગદર્શન-યોગવિદ્યાને સાચા અર્થમાં સમજ યોગસાધના દ્વારા જીવનને યોગમય, આનંદમય બનાવીએ... ઓમ...ઓમ...

'સહકાર' પાલિક અને 'ગ્રામસ્વરાજ' માસિકના જાહેરાતના દર

તા. ૧-૧૦-૨૦૧૬ થી

સહકાર પાલિક	અંકવાર	ગ્રામસ્વરાજ	જ માસિક	વાર્ષિક
૧. આખું પાન	૫,૦૦૦/-	૨૫,૦૦૦/-	૪૫,૦૦૦/-	૮૦,૦૦૦/-
૨. અડખું પાન	૩,૫૦૦/-	૧૬,૦૦૦/-	૩૦,૦૦૦/-	૪૦,૦૦૦/-
૩. પા પાન	૨,૫૦૦/-	૧૦,૦૦૦/-	૧૪,૦૦૦/-	૨૫,૦૦૦/-
૪. શુભેચ્છા	૧,૫૦૦/-	૮,૦૦૦/-	૧૨,૦૦૦/-	૨૦,૦૦૦/-

સહકાર પાલિકમાં જાહેરાતના છુટક ભાવ : અંક કોલમ સે.મી. રૂ.૧૦૦/-

'સહકાર' વિશેખાંક

૧. ટાઈટલ પાન-૪	૩૦,૦૦૦/-
૨. ટાઈટલ પાન-૨, ૩	૨૦,૦૦૦/-
૩. આર્ટ પેપર ફોર્કરલ	૧૦,૦૦૦/-
૪. અંદરનું આખું પાન	૫,૦૦૦/-
૫. અંદરનું અડખું પાન	૩,૦૦૦/-
૬. અંદરનું પા પાન	૨,૦૦૦/-

જાહેરાતોમાં લેંકોળા સરથેયાં - ટેલેન્ઝશીટસનો દર પાણા દીક રૂ.૬,૦૦૦/-

'ગ્રામસ્વરાજ' માસિક	અંકવાર	વાર્ષિક
૧. ટાઈટલ પાન-૪	૫,૦૦૦/-	૫૦,૦૦૦/-
૨. ટાઈટલ પાન-૨, ૩	૪,૦૦૦/-	૪૦,૦૦૦/-
૩. અંદરનું આખું પાન	૩,૦૦૦/-	૩૦,૦૦૦/-
૪. અંદરનું અડખું પાન	૨,૦૦૦/-	૨૦,૦૦૦/-
૫. પા પાન	૧,૦૦૦/-	૧૦,૦૦૦/-
૬. શુભેચ્છા	૫૦૦/-	૫,૦૦૦/-

GRAMSWARAJ GUJ. MONTHLY RNI No. 1799/57 Permitted to post at Ahmedabad P.S.O. on tenth of every month under postal Regd. No. GAMC 38/2024-26 issued by S.S.P. Ahmedabad valid upto 31-12-2026,
Licence to Post without prepayment No. PMG/GUJ/049/2024-26 Valid upto 31-12-2026 (Published on : 10-6-2024)

આંતરરાષ્ટ્રીય પોગ દિવસ : પોગ એટલે ભાગ આસન નથી, પરંતુ તેના આક અંગો છે

૧. ધમ : ધમ શાખ સંયમ રાખ પરંતુ આખ્યો છે જેનો અન્ય ધમ હેચેન્યાનિંગ વર્તન ધમના પાંચ માઝ છે.

અર્થિયા - મન, બ્યાન અને ક્રાફ્ટિંગ સોફ્ટેરને નુદ્દયાન ન કરવું

સંચ - ધમની દૂર સંપર્યાનું લાન, અસૌય - નહુસ અથવા ગોડીની ન કરવી, જાસ્તાખ્ય - બેનનાને જાસ્ત તાવ લાયે એકાંક્ષાર જાસ્તાખ્ય, અફરિકાટ - મંગળખોરી અથવા જીવયાન કરવો

૨. નિયમ : નિયમોના ધમ પાંચ પ્રકાર છે.

શીચ - અનુભિંદિ અને બાજુ સ્વચ્છતા, સંતોષ - જે છે તે પૂર્ણ છે એમ સ્વીકારવું નથી - સ્વચ્છને નિયમની આસન્યને બાધી નાખતું, સ્વાધ્યાય - આસના-પરાધાત્માનને સુધ્યજીવા માટે આસનાનું કરવો, ઈચ્છ પરિષાન - અભ્યાન પ્રતિ સમર્પણ, અંગોનાનો રૂપાંગ.

૩. આસન : પોગનો એ પ્રકાર જે વર્તમાન સમયમાં ઓદી વધુ પ્રયોગ છે તે આસન છે, આસન એ ભાગ શારીરિક કલ્યાણ નથી, બાટારી પલેજાનિંગ ને તેના વિશે સમજજીવના કલ્યું કર્યું કર્યું - સિલેક્ચર મુખ્ય આસન, શરીરની રિસેપ્શન અને મનમાં આનંદ અને સહજજીવન એ જ આસન છે, જો તમને આ એ રિસેપ્શનો ન મળે, તો તમે આસનમાં નથી.

૪. પ્રાણાયમ : પ્રાણાયમ એ શરીરમાં સૂધુ જીવન હજીનાને સુધુખીની સ્થાપના છે.

દોષ વાલાયાનું સહિતામાં, ધારુ (આસન ધાર) અને અધ્યાત્મ (અધ્યાત્મ જીવા આલ) પ્રાંતે સાધારણાના જોગજીવને પ્રાણાયમ નથી કર્યું છે, જીસાની મદદની આપણે શરીર અને મન ખેનેને જીવી જીવીને છીને, દરદ્યોગ જીંબ કરે છે 'ઘેરે કારે, યાણ જિલ' એટલે જરૂરી ધાર જીવાની આપણું મન તેજ બને છે અને જીવાને વધુનું કરવાની મનમાં પૂર્ણ રહે છે, સિલેક્ચર જીવનને જીસાની શક્તિ હારા જુદ્ધાન્ય પ્રાણ બધું, તે જ સમયે, જુરુ નાનક દરેક જીસાની રૂપને પરમાના જીવે જોગજીવા માટેની જીવી છે એમ કર્યું.

૫. પ્રનાઃકાર : અધ્યાત્મી પાંચ ૧૧ ઈન્ફિયો છે - એટલે કે, પાંચ શાનેન્યાનો, પાંચ ક્ર્યેન્યાનો અને એક મન, પ્રાણાયમ શાખ પ્રતિ અને આધ્યાત્મી બનેલો છે, એટલે કે ઈન્ફિયો જે વસ્તુઓનો અનેં હઈ રહી છે તેઓની તેને ખૂબ જોન (ન)

તરફ વાળવી. જીવાન લોકો કરે છે કે જે અક્ષિય તે હેડેક વસ્તુ ઇન્ફિયોની સાત હોડ આપણી હજીનિંગને પદાર્થ છે. પ્રાણાયમ એટલે ઈન્ફિયોની હોડ ત્યાને માન રહેંદું.

૬. પ્રારંભ : દેશ બંદ રિયાસ્ટ પારસ્થા' એટલે મનને એક જગતથે રિયાર રાખતું એ પારસ્થા છે. આપણે જાસ્તાખ્ય પારસ્થાને ધમન સમજજીવાની ભૂત કરીને છીએ. પારસ્થા એ મનને એકાંક્ષ કરવાની સાધના છે, તેના ધમાં સ્વરૂપો છે. જેમણે પ્રાણ-પારસ્થા એટલે કે ધારસાન કર્યું, જ્યાંનિ અથવા જિંદુ જાડુક વર્ણે, પારસ્થા એ હીકીકતમાં ધમન પોરાધીની અભિયાન છે. મનમાં રહેલા રિસેપ્શનોના પૂર્ણને કાળ્યાં રાખીને પારસ્થા આપવાને જીવિતિ આપે છે.

૭. ધારસાન : ધોં કૂણો કરે છે કે જ્યારે પારસ્થા રદી રહે છે, ત્યારે ધ્યાન ધમ છે, તે સ્વચ્છ જીવ છે કે આપણે ધ્યાન કરી શકતા નથી, પરંતુ ને વર્ષ જ્યા છે, એટલે કે ધ્યાન જીવની જ્યા છે. ધમાનના નામે આપણો છે પણ પદતિ કે પરિયા અપનાખીએ છીએ, તે જ ધારસાને પારસ્થા એટલે કે એકાંક્ષ નરક વર્ષ જ્યા રહે છે. ધ્યાન એ એવી રિસેપ્શન છે જ્યાં કર્યા, પદતિ અથવા પરિયાનું હજીલાન માટી જ્યા છે, ત્યા માત્ર જેક શુદ્ધતા રહે છે, ઉદાહરણ તરીકે, આપણે ઊંઘ પદ્ધતાં જીવજીવાની તેજારી કરીને છીએ, પરંતુ આતેયાની જીવની નેરેની નથી, તે આસનક જીવિત જ્યા છે.

૮. સમાપ્તિ : સમાપ્તિ શાખ ધમ એટલે કે જામાનના પરંતુ આખ્યો છે, ધોં પાતાનાખ્ય સહિતામાં આનાં અને પરમાયમ વાલોની સમજજીવાની રિસેપ્શને સમાપ્તિ કરીબાં જીવી છે. સમાપ્તિ પંચજીવિ કરે છે કે જાસ્ત ધોં તેની તેના કાલાંબિક સ્વરૂપ (સત્તા ચિન્તન અનંત સ્વરૂપ) માં દૂસી જ્યા છે, ત્યારે જીવજીવની તે સ્વચ્છિને જામાપ્તિ કરીબાં જીવી છે. જીવજીવાને સ્વરૂપ જીવિક અવસ્થાનું સ્વરૂપ છે. આ અવસ્થા વિકલ કરતાં જીવીર કરે છે. 'જીવ-જીવ હેઠું તથ-તથ પરિક્રમા, જે-જે કરી શકો હોય.'

૯. આ અવસ્થાને નિર્બંધ અને મધ્યાવીરે તેને કેવલ કરી શકે છે.

Publisher, Printer & Editor : Dr. Rayendra C. Trivedi

Owner : Gujarat State Co-operative Union, 'SAHYOG', Relief Road, Ahmedabad-380 001.

Published From : Gujarat State Co-operative Union, 'SAHYOG', Relief Road, Ahmedabad-380 001.

Printed at : Reliable Art Printery (Ahmedabad) Pvt. Ltd., 301, 3rd Floor, Punit Plaza,

B/H, Navgujarat College, Off. Ashram Road, Ahmedabad-380014, Gujarat